H. S. I. CODE.

દરેક વ્યાપારીએ રાખવા લાયક

ગુજરાતી ટેલીગ્રાફીક
કોડ બુક.

જેની અંદર એક શબ્દ (વર્ડ) માં સંપૂર્ણ ચાર
મતલબોનો સમાવેશ કરવામાં આવેલો છે.



રચનાર અને પ્રસિદ્ધ કરનાર,
હાજી. સુલેમાન ઈસ્માઈલ અંજારવાળા.
કચ્છી મેમન (મોહોમેડન).
હાલ મુકામ કચ્છ—ભુજ.

આવૃત્તિ. પહેલી. પ્રત. ૧૦૦૦

સંવત ૧૯૬૭.] ઈ. સ. ૧૯૧૧. [હીજરી સન ૧૩૨૯

કિંમત ફકત રૂ. ૨—૮.

અમદાવાદ.
યુનાઇટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી કંપની લિમિટેડના
પ્રેસમાં મનેજર રણછોડલાલ ગંગારામે છાપ્યું.

આ બુક મળવાનું ઠેકાણું—
કર્ત્તા—હાજી સુલેમાન ઈસ્માઈલ અંજાર વાળા પાસેથી.
ઠે. ઊમર જામમોહમદ અત્તર વાળાને ત્યાં. કચ્છ-ભુજ.
અને
શેઠ નુરમોહમદ હાજી મુસાની કુંપની. મુ. એડન. (કેમ્પ)
(અરેબીઆ).

સુચના

આએ બુકના ખરીદદાર સર્વ સદ્‌ગૃહસ્થ વ્યાપારીઓને વિનંતી સાથ અરજ કરવામાં આવે છે કે મેહેરબાની કરી આએ બુકને ફુરસદની વેળાએ શુરૂથી અંત્ય લગી એક ચિત્ત વાંચી ધ્યાનમાં લઈ મારા હાથે થયેલી ભુલભાલનો સુધારો કરી મને આભારી કરશો. ઉપરાંત બીજા કોલમમાં પોતાના વ્યાપારને લગતા માલના નામોની સમાવેશ નહી જણાય તો તે કોલમમાં છેલ્લે ખાલી (પોકલ) રાખવામાં આવેલ નંબરોમાં પોતાને જરૂર જણાતા માલના નામો દાખલ કરી લેવા.

ખાલી રાખવામાં આવેલા નંબરોમાં પોતાને જરૂર જણાતા માલના નામોની સમાવેશ નહી થઇ શકે તો લખેલા માલના નામો પોતાને જરૂરતના નહી જણાય તો તેવા માલના નામો કાપીને તેમાં વધારાના નામો દાખલ કરી લેવા.

તેમજ પેહેલા કોલમમાં સવાલ જવાબોની પોતાને જરૂર જણાતી હકીકત દાખલ કરવા માટે તે કોલમમાં પણ ઠેકાણે ઠેકાણે ખાલી (પોકલ) નંબરો રાખવામાં આવેલ છે તેમાં પોતાને જરૂર જણાતી હકીકતના સવાલ જવાબો દાખલ કરી લેવા.

વ્યાપારને લગતા તમામ ખર્ચમાં કરકસર જોવી એ વ્યાપારીનો એક નીયમ છે. જ્યારે ટેલીગ્રાફ ખર્ચ પણ વ્યાપારના અંગે છે તો તે ખર્ચમાં પણ અવસ્ય લાભ જોવું.

આએ બુકની અંદર પણ એક શબ્દ (વર્ડ) માં સંપૂર્ણ ચાર મતલબોનો સમાવેશ કરવામાં આવેલ છે જેથી આ બુકને ટેલીગ્રાફ સંદેશાના ઉપયોગમાં લેવાથી ટેલીગ્રાફ ખર્ચમાં ઓછામાં ઓછું સેંકડે (૭૫) પંચોતેર ટકા જેટલું લાભ થવા સંભવ છે માટે દરેક સાહેબોએ પોત પોતાના દોસ્ત આશનાઓને તેમજ એજંટોને આએ બુકનો લાભ લેવા માટે ઓછામાં ઓછી બબે નકલો અવસ્ય ખરીદવા ભલામણ કરવી. જ્યારે પોતે પણ લાભ લેવા ચુકવું નહી.

હિન્દુસ્તાનમાં હીન્દુસ્તાનની અંદરના ભાગ માટે ટેલીગ્રાફનો દર નામ ગામ સહીત (૧૨) બાર શબ્દોના ફક્ત (૦।≈) ૭ આના છે જયારે હીન્દુસ્તાનમાં વસનારા કેટલાએક વ્યાપારી સાહેબો, એવું પણ ખ્યાલ કરશે કે જુજ ખર્ચ માટે કોડ બુક વાપરવાની કડાકુટ શા માટે જોઇએ. પણ મારી સમજ મુજબ તે સાહેબોએ તેવા ખ્યાલને દુર કરી આએ બુકનો અવશ્ય ઉપયોગ કરવો કારણ કેટલાએક વ્યાપારીઓ અંગ્રેજી જાણતા નથી પણ સેહેજ અંગ્રેજી આંકડાઓ અને એ. બી. સી. ના અક્ષરો એટલુંજ જાણે છે તો તેવા સાહેબોને તાર લખવું કે વાંચવું હોય તો અંગ્રેજી જાણનારા પાસે જવું પડે છે અથવા તો સંદેશાની નકલ ગુજરાતીમાં લખી નોકર ચાકર મારફત અંગ્રેજી જાણનારા પાસે મોકલવી પડે છે, જેથી પોતાનો છુપો ભેદ બીજાઓ જાણી શકે છે માટે હિન્દુસ્તાનમાં વસનારા વ્યાપારીઓએ પણ અવશ્ય આએ બુકનો ઉપયોગ કરવો.

ઉપરાંત વ્યાપારને લગતી હકીકત માટેનો લાંબો સંદેશો કે જે ખુલ્લો લખવાથી લગભગ રૂ. ૧ થી ૧। ચાર્જ આપવો પડે તેવો સંદેશો પણ આએ બુક મારફત ફકત (૦।≈) ૭ આના ખર્ચે પોહોચાડી શકાશે. જેથી ખર્ચમાં પણ જરૂર લાભ થશેજ.

લી૦ કર્ત્તા.

હાજી સુલેમાન ઇસ્માઇલ અંજાર વાળા.

પ્રસ્તાવના

ટેલીગ્રાફ ખાતાએ વ્યાપારી કોડ બોલ એ બી. સી. માંના દશ અક્ષરો સુધીનો એક શબ્દ (વર્ડ) માં લેવા કાયદો રાખેલ છે. શબ્દ (વર્ડ) જો કે સમજ વગરનો હોય તો પણ સરળ વાંચી શકાય તેવો જોડાઅક્ષરો સાથનો હોવો જોઇએ.

સદરહુ ટેલીગ્રાફ ખાતાના કાયદાને અનુસરી આએ બુકમાં પણ એ. બી. સી. ના દશ અક્ષરોનો શબ્દ (વર્ડ) જો કે સમજ વગરનો તોપણ સરળ વાંચી શકાય તેવો જોડાઅક્ષરો સાથનો કાયદામાં એક શબ્દ (વર્ડ) ની ગણત્રીને બાદ ન લાગે તેવો થવા માટેની ગોઠવણ કરવામાં આવેલ છે. અને તેવા દશ અક્ષરોના શબ્દ (વર્ડ) માં વ્યાપારને લગતા તમામ ખરીદી વેચાણ અને ચડતવીશેના સવાલ જવાબો કે જે સાથે માલનો નામ તથા તેની કીમત (ભાવ) અને દાગીનાની સંખ્યા સહીત સંપૂર્ણ થઈ શકે તેવી ગોઠવણથી આએ બુકને તૈયાર કરવામાં આવેલ છે.

ઉપર જણાવ્યા મુજબ સવાલ જવાબોની હકીકત સાથે માલનો નામ તથા તેની કીમત (ભાવ) અને દાગીનાની સંખ્યા મળી ચાર મતલબોનો સમાવેશ દશ અક્ષરોના એક શબ્દ (વર્ડ)માં થવા માટે આએ બુકને ચાર ભાગે વેહેંચી નાંખવામાં આવેલ છે અને તે ભાગોને નીચે જણાવ્યા મુજબ કોલમોને નામે ઓળખાવ્યા છે.

(૧) કોલમ પેહેલું સવાલ જવાબોની પર્ટીકયુલરો (હકીકતો) માટે ત્રણ અંકી નંબરોનો તે પેહેલો, બીજો અને ત્રીજો અંક.

(૨) કોલમ બીજું માલના નામો માટે ત્રણ અંકી નંબરોનો. તે ચોથો પાંચમો અને છઠો અંક.

(૩) કોલમ ત્રીજું કીમત (ભાવ) માટે બે અંકી નંબરોનો તે સાતમો અને આઠમો અંક.

(૪) કોલમ ચોથું દાગીનાની સંખ્યા માટે બે અંકી નંબરોનો તે નવમો અને દશમો અંક.

એણી રીતે ચારે કોલમોની હકીકતો દશ અંકોમાં સમાવેશ કરેલી છે. ટેલીગ્રાફ ખાતાના કાયદામાં પાંચ અંકી નંબર એક શબ્દ (વર્ડ) માં ગણાય છે. જેથી તે દશ અંકોના નંબરનો શબ્દ (વર્ડ) દશ અક્ષરોએ થવા માટે તે અક્ષરો આએ બુકમાં પાને ૧૩૯ માં ગોઠવેલા છે તે અક્ષરો એ શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ નીચે જણાવવામાં આવેલા દાખલાઓથી સમજવામાં આવશે.

ઉપરાંત બે માલના ભાવોની સમાવેશ પણ એક શબ્દ (વર્ડ)માં થવા માટેની સમજ તેમજ આમન સામન ઑફરો વીશેના સવાલ જવાબો, બાગરકસો વીશેની ખબરો. આસામીઓની રવાનગી અને સ્થીતી વીશેના સમાચારો. તાર અને કાગળો વીશેના સવાલ જવાબો. ભાવ અને રૂખ વીશેના સમાચારો, વરસાદ અને પાક વીશેના સમાચારો, અવેજ અને હુંડી હવાલાઓ વીશેના સવાલ જવાબો. માલની ડીલીવરી વીશેના સવાલ જવાબો, માલ ડામીચ ફાટટુટ વગેરે નુકસાન થયેલા વીશેના સમાચારો. લીલામ વીશેના સમાચારો. સી. આઇ. એફ. હારબર અને વાયદાના સાટા શોદા વીશેના સવાલ જવાબો, કંટરાકટ વીશેના સવાલ જવાબો, અને પરચુરણ વરધીઓ તથા વાંધાવિસ્ટી કજીઆકેસ વીશેના સવાલ જવાબો વગેરેમાંથી કોઇ પણ સવાલ જવાબોની ત્રણ હકીકતો એક શબ્દ (વર્ડ) માં સમાવેશ થવા માટેની પણ સમજ નીચે બતાવવામાં આવેલા દાખલાઓથી સમજવામાં આવશે.

કર્ત્તા.

હાજી સુલેમાન ઇસમાઇલ અંજાર વાળા.

અંકો ઓળખવા માટેના અક્ષરો પાના ૧૩૯ થી ૧૪૦ માં ગોઠવેલા છે તે અક્ષરોએ શબ્દો (વર્ડો) ગોઠવવાની સમજ.

(૧) જો ચારે કોલમોની હકીકત માટે દશ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવો હોય તો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો.

(૨) જો પેહેલા કોલમના સવાલ જવાબોમાંથી બે સવાલ જવાબોની પર્ટીકયુલરો (હકીકતો) માટે ૭ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવો હોય તો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો.

(૩) જો પેહેલા કોલમના સવાલ જવાબોમાંથી ત્રણ સવાલ જવાબોની પર્ટીકયુલરો (હકીકતો) માટે નવ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવો હોય તો.

(૧) પેહેલા આઠ અંકો. પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવા.

(૨) છેલ્લે નવમા અંક માટેનો અક્ષર જે એક એક અંક ઓળખવા માટેના દશ અક્ષરો ગોઠવેલા છે તેમાંથી લઇને પેહેલા આઠ અક્ષરોના જોડે છેલ્લે મુકવો.

(૪) જો બે માલના ભાવો માટે દશ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવો હોય તો બીજા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો.

એવી રીતે શબ્દો (વર્ડો) ગોઠવવાની સમજ ધ્યાનમાં રાખવી.

લી૦ કર્ત્તા.

હાજી સુલેમાન ઇસ્માઇલ અંજાર વાળા.

સમજાણ

ચારે કોલમોની હકીકત માટે દશ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ.

(૧) દાખલો પેહેલો—એડનથી કલકત્તા વાળાને તાર કરવું છે કે.

ચડાવો પેહેલી જોગવાઇએ ચોખા રાડી. ર. ૩ાા ના ભાવના બસ્તા ૫૦૦)

સદરહુ તાર લખનારે પહેલો કોલમ જે સવાલ જવાબોની હકીકતો માટેનો છે તેમાં ચડાવો પેહેલી જોગવાઇએ તે ઉપરનો ત્રણ અંકી નંબર 410 છે તે લેવો અને તે પછી બીજો કોલમ જે માલના નામો માટેનો છે તેમાં ચોખા રાડી ઉપરનો ત્રણ અંકી નંબર 199 છે તે લઇને પેહેલા નંબરની જોડે મુકવો અને તે પછી ત્રીજો કોલમ જે કીમત (ભાવ) માટેનો છે તેમાં ૩ાા ની સંખ્યા ઉપરનો બે અંકી નંબર 34 છે તે લઇને પેહેલા બે નંબરોની જોડે મુકવો અને તે પછી છેલ્લે ચોથો કોલમ જે દાગીનાની સંખ્યા માટેનો છે તેમાં ૫૦૦) ની સંખ્યા ઉપરનો બે અંકી નંબર 34 છે તે લઇને પેહેલા ત્રણ નંબરોની જોડે છેલ્લે મુકવો મળી દશ અંકી નંબર થશે. જેમ કે 410, 199, 34, 34.

સદરહુ નંબરનો શબ્દ (વર્ડ) ઉપર જણાવવામાં આવેલ અંકોના શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ પાના ૭ માં છે તે મુજબ પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો. જેમ કે 41 01 99 34 34

Bibayusese Bi Ba Yu Se Se

પેહેલા કોલમના સવાલ જવાબોની એ પર્ટીકયુલરો (હકીકતો) માટે ૭ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ.

(૨) દાખલો બીજો—મુંબાઇથી એડનવાળાને તાર કરવું છે કે.

કાગળ મળ્યા પણ અવેજ નીકળ્યો નહી અવેજ ટેલીગ્રાફ મારફત અપાવો.

સદરહુ તાર લખનારે પેહેલો કોલમ જે સવાલ જવાબોની પર્ટીકયુલરો (હકીકતો) માટેનો છે તેમાં કાગળ મળ્યા પણ અવેજ નીકળ્યો નહી તે ઉપરનો ત્રણ અંકી નંબર 681 છે તે લેવો અને તે પછી અવેજ ટેલીગ્રાફ મારફત અપાવો. તે ઉપરનો જે ત્રણ અંકી નંબર 746 છે તે લઇને પેહેલા નંબરની જોડે મુકવો મળી ૭ અંકી નંબર થશે જેમકે 681, 746.

સદરહુ નંબરનો શબ્દ (વર્ડ) ઉપર જણાવવામાં આવેલ અંકોનો શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ પાના ૭ માં છે તે મુજબ પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવો જેમ કે 68 17 46.

Kowahi Ko Wa Hi

પેહેલા કોલમના સવાલ જવાબોની ત્રણ પર્ટીકયુલરે (હકીકતો) માટે નવ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ.

(૩) દાખલો ત્રીજો—મુંબાઇથી એડનવાળાને તાર કરવું છે કે

કાગળ મળ્યા પણ અવેજ નીકળ્યો નહી અવેજ ટેલીગ્રાફ

મારફ્ત અપાવો અવેજ મોકલવામાં આળસ કરશો તો

અમોને બહુ મુંઝવણ થશે.

સદરહુ તાર લખનારે પેહેલો કોલમ જે સવાલ જવાબોની પર્ટીકયુલરો (હકીકતો) માટેનો છે તેમાં કાગળ મળ્યા પણ અવેજ નીકળ્યો નહી તે ઉપરનો જે ત્રણ અંકી નંબર 681 છે તે લેવો અને તે પછી અવેજ ટેલીગ્રાફ મારફ્ત અપાવો તે ઉપરનો જે ત્રણ અંકી નંબર 746 છે તે લઇને પેહેલા નંબરની જોડે મુકવો અને તે પછી જો અવેજ મોકલવામાં આળસ કરશો તો અમોને બહુ મુઝવણ થશે તે ઉપરનો જે ત્રણ અંકી નંબર 752 છે તે લઇને પેહેલા બે નંબરોની જોડે છેલ્લે મુકવો મળી નવ અંકી નંબર થશે જેમ કે 681, 746, 752.

સદરહુ નંબરનો શબ્દ (વર્ડ) ઉપર જણાવવામાં આવેલ અંકોના શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ પાને ૭ માં છે તે મુજબ પેહેલા આઠ અંકો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવા જ્યારે છેલ્લા નવમા અંક માટેનો અક્ષર તે એક એક અંક ઓળખવા માટેના જે દશ અક્ષરો ગોઠવેલા છે. તેમાંથી લેવો જેમ કે

	68	17	46	75	2
Kowahitoc	Ko	Wa	Hi	To	C

એ માલના ભાવો માટે દશ અંકી નંબરનો શબ્દ (વર્ડ) ગોઠવવાની સમજ.

(૪) દાખલો ચોથો—એડનથી મુંબાઇવાળાને તાર કરવું છે કે.

ચોખા રાડીનો ભાવ રૂ. ૯ાા અને ખાંડ વિલાયતી બી. આર. બી. નો ભાવ રૂ. ૨૨ાા.

સદરહુ તાર લખનારે બીજો કોલમ જે માલના નામો માટેનો છે તેમાં ચોખા રાડી ઉપરનો જે ત્રણ અંકી નંબર 199 છે તે લેવો અને તેપછી ત્રીજો કોલમ જે કીમત (ભાવ) માટેનો છે તેમાં ૯ાા ની સંખ્યા ઉપરનો જે બે અંકી નંબર 93 છે તે લઇને પેહેલા નંબરની જોડે મુકવો મળી એક માલના ભાવ માટે પાંચ અંક થયા એવીજ રીતે ખાંડ વિલાયતીના ભાવ માટે પણ બીજા કોલમમાંથી ખાંડ વિલાયતી ઉપરનો જે ત્રણ અંકી નંબર 372 છે તે લેવો અને તે પછી ત્રીજા કોલમમાંથી ૨૨ાા ની સંખ્યા ઉપરનો જે બે અંકી નંબર 78 છે તે લઇને છેલ્લે મુકવો મળી બે માલના ભાવો માટેનો દશ અંકી નંબર થશે જેમ કે 199, 93, 372, 78.

સદરહુ નંબરનો શબ્દ (વર્ડ) ઉપર જણાવવામાં આવેલ અંકોના શબ્દ (વર્ડ) ગોઠવવા માટેની સમજ પાને ૭ માં છે તે મુજબ. બીજા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો. જેમ કે 19 99 33 72 78

Azuzesoroy Az Uz Es Or Oy

એણી રીતે શબ્દો (વર્ડો) ગોઠવવાની સમજ ધ્યાનમાં રાખવી.

લી૦ કર્તા.

હાજી સુલેમાન ઇસ્માઇલ અંજાર વાળા.

કીંમત [ભાવ]

ત્રીજા કોલમમાં ભાવના માટે દરેક નંબરમાં સાત સાત સંખ્યાઓ બતાવવામાં આવેલ છે પણ તે સંખ્યાઓ ઘણા મોટા તફાવતે હોવાથી માલના નામ જોડે સેહેલ સમજી શકાશે કે. અમુક સંખ્યા ભાવના માટે છે જેમ પેહેલા દાખલામાં ચોખા રાડી રૂ. ૩ાા ના ભાવે ખરીદવા કલકત્તાવાળાને જણાવવામાં આવેલ છે તો તે નંબર 34 માં ભાવના માટે ૦ાા= ૩ાા ૧૪ાા ૩૭ાા ૯૦ ૨૦૭ાા અને ૪૪૨ાા મળી સાત સંખ્યાઓ કલકત્તા વાળાને જોવામાં આવશે અને તે ચોખા રાડીના માટે મજકુર સાત સંખ્યાઓમાંથી ૩ાા ની સંખ્યા જરૂર અમલમાં લેશેજ. કારણ કલકતામાં ચોખા બંગાળી મણના ભાવે વેચાય છે જ્યારે મજકુર સાત સંખ્યાઓમાંથી ૩ાા ની સંખ્યા તેને અમલમાં લેવી ફરજ પડશેજ.

તેમજ ચોથા દાખલામાં એડનથી મુંબઇવાળાને ચોખા રાડીનો ભાવ રૂ. ૯ાા અને ખાંડ વિલાયતીનો ભાવ રૂ. ૨૨ાા નો જણાવવામાં આવેલ છે જ્યારે મુંબાઈ વાળો ચોખા રાડીના જોડે ભાવની સંખ્યા માટેનો નંબર જોશે તો તે નંબર 93 માં ૧ાા ૯ાા ૨૬ાા ૬૭)= ૧૫૩ાા ૩૬૦ અને ૬૦૨ાા મળી સાત સંખ્યાઓ મુંબઇવાળાને જોવામાં આવશે અને તે ચોખા રાડીના ભાવ માટે મજકુર સાત સંખ્યાઓમાંથી ૯ાા ની સંખ્યા જરૂર અમલમાં લેશેજ. કારણ એડનમાં ચોખા ઉઘડા બસ્તા (ગુણી) ના ભાવે વેચાય છે જ્યારે મજકુર સાત સંખ્યાઓમાંથી ૯ાા ની સંખ્યા તેને અમલમાં લેવી ફરજ પડશેજ.

એવીજ રીતે મુંબાઇવાળો ખાંડ વિલાયતીના જોડે ભાવની સંખ્યા માટેનો નંબર જોશે તો તે નંબર 78 માં ૧૦ાા ૭ાા= ૨૨ાા ૫૯ાા ૧૩૫ ૩૦૭ાા અને ૫૭૦ાા મળી સાત સંખ્યાઓ તેને જોવામાં આવશે અને તે ખાંડ વિલાયતીના ભાવ માટે મજકુર સાત સંખ્યાઓમાંથી ૨૨ાા ની સંખ્યા જરૂર અમલમાં લેશેજ. કારણ એડનમાં ખાંડ વિલાયતી ઉઘડી બસ્તા (ગુણી) ના ભાવે વેચાય છે જ્યારે મજકુર સાત સંખ્યાઓમાંથી ૨૨ાા ની સંખ્યા તેને અમલમાં લેવી ફરજ પડશેજ.

ઉપરાંત કેટલાક માલ એવા પણુ હોય છે જે સદરહુ ભાવોની સાત સંખ્યાઓમાંથી કઈ સંખ્યા તે માલના ભાવ માટે સમજવી તો તેવા શંકાશીલ ભાવ માટે ભાવોના દરેક નંબરમાં સાત સાત સંખ્યાઓમાંથી એક એક સંખ્યા આનાપાણુ વગરની મોટા અંકોએ બતાવવામાં આવેલ છે તેમજ પેહેલા કોલમમાં દરેક ઠેકાણે આનાપાણુ વગરની સંખ્યાના ભાવે ખરીદો વેચો અને ચડાવો વગેરે એવા સવાલ જવાબો દાખલ કરવામાં આવેલ છે કે જેથી તેવા શંકાશીલ ભાવો આનાપાણુ વગરની સંખ્યાએ જણાવવા તોપણુ સમજના માટે એક દાખલો આ નીચે બતાવવામાં આવેલો છે તે મુજબ ધ્યાનમાં લેવું.

(૫) દાખલો પાંચમો—એડનથી મુંબઇવાળાને તાર કરવું છે કે.

ચડાવો સીવવાના સાંચા રૂ. ૬૦ ના ભાવના નંગ ૨૫.

સદરહુ તાર લખનારે પેહેલો કોલમ જે સવાલ જવાબોની હકીકતો માટેનો છે તેમાં ચડાવો બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ ખરીદ કરીને તે ઉપરનો જે ત્રણુ અંકી નંબર 415 છે તે લેવો અને તે પછી બીજો કોલમ જે માલના નામો માટેનો છે તેમાં શીવવાના સાંચા ઉપરનો જે ત્રણુ અંકી નંબર 095 છે તે લઇને પેહેલા નંબરની જોડે મુકવો અને તે પછી ત્રીજો કોલમ જે કીમત (ભાવ) માટેનો છે તેમાં ૬૦ ની સંખ્યા ઉપરનો જે બે અંકી નંબર 79 છે તે લઇને પેહેલા બે નંબરોની જોડે મુકવો અને તે પછી છેલ્લે ચોથો કોલમ જે દાગીનાની સંખ્યા માટેનો છે તેમાં ૨૫ ની સંખ્યા ઉપરનો જે બે અંકી નંબર 14 છે તે લઇને પેહેલા ત્રણુ નંબરોની જોડે છેલ્લે મુકવો મળી દશ અંકી નંબર થશે જેમ કે 415, 095, 79, 14.

સદરહુ નંબરનો શબ્દ (વર્ડ) ઉપર જણાવવામાં આવેલ અંકોના શબ્દો (વર્ડો) ગોઠવવાની સમજ પાને ૭ માં છે તે મુજબ પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવો જેમ કે 41 50 95 79 14

	41	50	95	79	14
Bimituyosa	Bi	Mi	Tu	Yo	Sa

દરેક ચલણમાં કીમત (ભાવ) નો ઉપયોગ કરવાની સમજ.

ભાવ જો કે રૂપીઆ અને આનાઓથી બતાવવામાં આવેલ છે તોપણ દરેક ચલણના ઉપયોગમાં લેવાનું બની શકશે જે નીચે મુજબ.

(૧) ડૉલરના ચલણમાં આના એકના સવા૬ દોકડા ગણવા.

(૨) શાલના ચલણમાં આના એકના પાંચ કબીરા ગણવા.

(૩) શાલ ઉમલોના હીસાબમાં આના એકની અઢી રીજીન ગણવી.

(૪) ફ્રાન્કના ચલણમાં આના એકની સવા૬ સીન્ટી ગણવી.

(૫) શીલીંગના ચલણમાં નીચે મુજબ ગણત્રી કરવી.

૦)- એક આનાની એક પેની.
૦)= બે આનાની બે પેની.
૦। ચાર આનાની (પા શીલીંગ) ત્રણ પેની.
૦।- પાંચ આનાની ચાર પેની.
૦।= ૬ આનાની પાંચ પેની.
૦॥ આઠ આનાની (અર્ધો શીલીંગ) ૬ પેની.
૦॥- નવ આનાની સાત પેની.
૦॥= દશ આનાની આઠ પેની.
૦।॥ બાર આનાની (પોણો શીલીંગ) નવ પેની.
૦।॥- તેર આનાની દશ પેની.
૦।॥= ચૌદ આનાની અગીઆર પેની.
૧) એક રૂપીઆને એક શીલીંગની ગણત્રીમાં લેવું (બારપેની.)

એવી રીતે શીલીંગોના ચલણમાં ઉપયોગ કરવો પણ ૦)≡ ૦।≡ ૦॥≡ અને ૦।॥≡ ને ગણત્રીમાં લેવું નહી.

સાંકળીઉ

કોલમ પેહેલું સવાલ જવાબો માટેનો.

કોલમ બીજું માલના નામો માટેનો.

H. S. J. Code.

ગુજરાતી ટેલીગ્રાફીક
કોડ બુક.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).
001	० ० ० ० ખાલી. (નકામું.)
002	**ખરીદો** (ખરીદ કરો). બજારભાવે.
003	ખરીદો. જો બતાવેલા ભાવે મળે તો.
004	ખરીદો. બતાવેલા ભાવોમાં આના પાણુ વગરની સંખ્યાએ
005	ખરીદો. જો તમારૂં ધ્યાન પહોંચે તો.
006	ખરીદો. જણાવેલી શરતે.
007	ખરીદો. અગાઉની શરતે.
008	ખરીદો. આગળના જેવું. (અગાઉ જેવું.)
009	ખરીદો. આવતું અથવા જણાવેલા બારકસનું.
010	ખરીદો. જણાવેલા તોલ, માપ અથવા મારકા મેકરનું

નંબર.	(પર્ટીકયુલર.)
021	ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ચાર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
022	ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી પાંચ સીપમેન્ટ. દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
023	ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી છ શીપમેન્ટ. દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
024	ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ. જો ટાઇમસર ડીલીવરી લઇએ નહી તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ.

011 ખરીદો. જેટલું મળી શકે તેટલું.

012 ખરીદો. જો લીલામ થાય તો.

013 ખરીદો. જણાવેલી આશામી વેચે તો.

014 ખરીદો. ઉધડું બતાવેલી સંખ્યાએ મળે તો.

015 ખરીદો. પહોંચતું. કીનારા ઉપર ડીલીવરી લેવાની શરતે

016 ખરીદો. પહોંચતું. સી. આઈ એફ. હારબરની શરતે ચાલુ માસની શીપમેન્ટ.

017 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

018 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

019 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી બે સીપમેન્ટ. દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

020 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

025 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબરે આવતા માસની શીપમેન્ટ જો ટાઇમસર ડીલીવરી નહી લઇએ તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ.

026 ખરીદો. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ જો ટાઇમસર નહી ઉચકીએ તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ

027 ખરીદો. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી બે શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. પણ જો ટાઇમસર ડીલીવરી લઇએ નહી તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ

028 ખરીદો. પહોંચતું. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે પણ જો ટાઇમસર ડીલીવરી લઇએ નહી તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ.

029 ખરીદો. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧-૨-૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).
030	ખરીદો. માસ ૨ પછી ડીલીવરી લેવાની શરતે.
031	ખરીદો. માસ ૨ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે લેવાની શરતે જણાવેલા મહીનાથી.
032	ખરીદો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે લેવાની શરતે જણાવેલા મહીનાથી.
033	ખરીદો. અને વળતો જવાબ તારથી આપો.
034	ખરીદો. અને અવેજ પેટે હુંડી (હવાલા) અમો ઉપર લખો.
035	ખરીદો. ડીલીવરી બાદ એક માસ પછી નાણા આપવાની શરતે.
042	ખરીદાવો. (જણાવેલા પોર્ટમાં અથવા આશામી મારફત)
043	ખરીદાવો. બતાવેલા ભાવે (જણાવેલા પોર્ટમાં અથવા આશામી મારફત.)
044	ખરીદાવો. બતાવેલા ભાવોમાં આનાપાઇ વગરની સંખ્યાએ જણાવેલા પોર્ટમાં અથવા આશામી મારફત.
045	ખરીદાવે. જણાવેલા તોલ : માપ અથવા મારકા મેકરનું.
046	ખરીદાવો. જો તમારૂં ધ્યાન પોહોંચે તો.

036 ખરીદો. ડીલીવરી બાદ બે માસ પછી નાણા આપવાની શરતે.

037 ખરીદો. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદત સર નાણા આપવાની શરતે.

038 ખરીદો. બારકસની લૅાંગસાઇડમાં પોહોચતું.

039 ખરીદો. પોહોચતું કીનારા ઉપર ડીલીવરી લેવાની શરતે.

040 ખરીદો. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે જો વખતસર નહી ઉચકીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

041 ખરીદો. માસ ૩ ની છુટી ડીલીવરી જણાવેલા મહીનાથી દર મહીને સરખે ભાગે લેવાની શરતે તો પણ જો વખતસર નહીં ઉચકીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

047 ખરીદાવો. જણાવેલી શરતે.

048 ખરીદાવો. અગાઉની શરતે.

049 ખરીદાવો. આગલ જેવું.

050 ખરીદાવો. જેટલું મળી શકે તેટલું.

051 ખરીદાવો. જો લીલામ થાય તો

052 ખરીદાવો. ઉધડું બતાવેલી સંખ્યાએ મળે તો.

053 ખરીદાવો. જણાવેલ આશામી વેચે તો.

054 ખરીદાવો. આવતુ અથવા જણાવેલા બારકસનું.

055 ખરીદાવો. પોહોચતુ કીનારા ઉપર ડીલીવરી લેવાની સરતે.

056 ખરીદાવો. જો વેચનાર ધણી બારકશની લૅાંગસાઇડમાં ડીલીવરી આપે તો.

057 ખરીદાવો. પોહોચતુ સી. આઇ. એફ. હારબર ચાલુ માસની સીપમેન્ટ.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧–૨–૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).
058	ખરીદાવો. પોહોચતું સી. આઈ. એફ. હારબર આવતા માસની સીપમેન્ટ.
059	ખરીદાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.
060	ખરીદાવો પોહોચતું સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
061	ખરીદાવો પોહોચતું સી. આઇ. એફ હારબર જણાવેલા મહીનાથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
062	ખરીદાવો. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે.
069	ખરીદીએ. (ખરીદ કરીએ.)
070	ખરીદીએ. બતાવેલા ભાવે મળે તો.
071	ખરીદીએ બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ.
072	ખરીદીએ. ઉઘડું બતાવેલી સંખ્યાએ.
073	ખરીદીએ જણાવેલી સરતે.
074	ખરીદીએ અગાઉની સરતે.
075	ખરીદીએ. આગળ જેવું.

063 ખરીદાવો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે ડીલીવરી લેવાની શરતે.

064 ખરીદાવો. ડીલીવરી બાદ એક મહીને નાણા આપવાની શરતે.

065 ખરીદાવો. ડીલીવરી બાદ બે મહીને નાણા આપવાની શરતે.

066 ખરીદાવો. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણા આપવાની શરતે.

067 ખરીદાવો. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે પણ જો વખતસર નહી ઉચકીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

068 ખરીદાવો. માસ ૩ ની છુટી ડીલીવરી જણાવેલા મહીનાથી દર મહીને સરખે ભાગે ડીલીવરી લેવાની સરતે પણ જો વખતસર નહીં ઉચકીએ તો જણાવેલા ભાવે નુકસાની આપતા રહીએ.

076 ખરીદીએ. જો તમારૂં ધ્યાન પોહોચે તો.

077 ખરીદીએ જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનું.

078 ખરીદીએ. લીલામમાં.

079 ખરીદીએ. જણાવેલ આશામીનું.

080 ખરીદીએ. આવતું અથવા જણાવેલા બારકસનું.

081 ખરીદીએ. માસ ૧ પછી ડીલીવરી લેવાની સરતે.

082 ખરીદીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે લેવાની સરતે.

083 ખરીદીએ માસ ૬ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે લેવાની શરતે.

084 ખરીદીએ ડીલીવરી સાથે નાણા આપવાની સરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી બરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).
085	ખરીદીએ. ડીલીવરી બાદ એક મહીને નાણા આપવાની સરતે.
086	ખરીદીએ. ડીલીવરી બાદ બે મહીને નાણા આપવાની સરતે.
087	ખરીદીએ. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણા આપવાની સરતે.
088	ખરીદીએ. બારકસની લૉંગસાઇડમાં વેચનાર ધણી પોહોચતું કરશે.
089	ખરીદીએ. પોહોચતું કીનારે ડીલીવરી.
090	ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

નંબર.	(પર્ટીક્યુલર)
097	ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ ડીલીવરી બાદ એક મહીને નાણા આપવાની સરતે.
098	ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ ડીલીવરી બાદ એક મહીને નાણા આપવાની સરતે.
099	ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ૬ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ ડીલીવરી બાદ એક મહીને નાણા આપવાની સરતે.

091 ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર આ-
વતા માસની શીપમેન્ટ.

092 ખરીદીએ. પોહોતું સી. આઇ. એફ. હારબર જણાવે-
લા માસની સીપમેન્ટ.

093 ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણા-
વેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે
ભાગે શીપમેન્ટ.

094 ખરીદીએ. પોહોચતું. સી. આઇ. એફ. હારબર જ-
ણાવેલા મહીનાથી ૬ શીપમેન્ટ દર મહીને સર-
ખે ભાગે શીપમેન્ટ.

095 ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ
માસની શીપમેન્ટ ડીલીવરી બાદ એક મહીને
નાણા આપવાની સરતે.

096 ખરીદીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર આ-
વતા માસની શીપમેન્ટ ડીલીવરી બાદ એક
મહીને નાણા આપવાની સરતે.

100 ખરીદીએ. માસ ૧ પછી ડીલીવરી લેવાની સરતે
પણ જો વખતસર નહી ઉચકીએ તો.જણાવેલા
ભાવે નુકસાની આપી છુટીએ.

101 ખરીદીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને
સરખે ભાગે લેવાની સરતે પણ જો વખતસર
નહીં ઉચકીએ તો જણાવેલા ભાવે નુકસાની
આપતા રહીએ.

102 ખરીદીએ. માસ ૬ ની છુટી ડીલીવરી દર મહીને
સરખે ભાગે લેવાની સરતે પણ જો વખતસર
નહીં ઉચકીએ તો જણાવેલા ભાવે નુકસાની
આપતા રહીએ.

103 **ખરીદાવીએ** (જણાવેલા પોર્ટમાં અથવા આ-
શામી મારફત).

104 ખરીદાવીએ બતાવેલા ભાવે મળે તો.

105 ખરીદાવીએ બતાવેલા ભાવોમાં આના પાણ વગરની
સંખ્યાએ.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
106	ખરીદાવીએ ઉઘડું બતાવેલી સંખ્યાએ.	121	ખરીદાવીએ. બારકસની લૉંગ સાઇડમાં વેચનાર ધણી પહોંચતું કરી આપે તો.
107	ખરીદાવીએ જણાવેલી શરતે.	122	ખરીદાવીએ. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે.
108	ખરીદાવીએ અગાઉની શરતે.	123	ખરીદાવીએ. માસ ૨ પછી ડીલીવરી લેવાની શરતે.
109	ખરીદાવીએ. આગળ જેવું.	124	ખરીદાવીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે લેવાની શરતે.
110	ખરીદાવીએ જેટલું મળી શકે તેટલું.	125	ખરીદાવીએ. ડીલીવરી બાદ એક મહીને નાણું આપવાની શરતે.
111	ખરીદાવીએ જો તમારૂં ધ્યાન પહોંચે તો.	126	ખરીદાવીએ. ડીલીવરી બાદ બે મહીને નાણું આપવાની શરતે.
112	ખરીદાવીએ જો લીલામ થાય તો.		
113	ખરીદાવીએ જણાવેલ આશામીનું.		

114 ખરીદાવીએ આવતું અથવા જણાવેલા બારકસનું.

115 ખરીદાવીએ. પહોંચતું. કીનારે ડીલીવરી લેવાની શરતે.

116 ખરીદાવીએ પહોંચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

117 ખરીદાવીએ. પહોંચતું. સી. આઈ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

118 ખરીદાવીએ. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

119 ખરીદાવીએ. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

120 ખરીદાવીએ. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

127 ખરીદાવીએ. ડીલેવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદ્દતસર નાણાં આપવાની શરતે.

128 **ખરીદશું** (ખરીદ કરશું).

129 ખરીદશું. જો બતાવેલા ભાવે મલશે તો.

130 ખરીદશું. જો બતાવેલા ભાવોમાં આના પાણ વગ-રની સંખ્યાએ મલશે તો.

131 ખરીદશું. જો ઉધડું બતાવેલી સંખ્યાએ મલશે તો.

132 ખરીદશું. જણાવેલી શરતે.

133 ખરીદશું. અગાઉની શરતે.

134 ખરીદશું. આગળના જેવું.

135 ખરીદશું. લીલામ થશે તો.

136 ખરીદશું. જણાવેલ આશામીનું.

137 ખરીદશું. આવતું અથવા જણાવેલા બારકસનું.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
138	ખરીદશું. જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનું.	149	ખરીદશું ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણાં આપવાની શરતે.
139	ખરીદશું. પહોંચતું. બારકસની લૉંગ સાઇડમાં ડીલીવરી મળશે તે.	150	તમોએ કેટલું ખરીદયું તે તારથી જણાવો.
140	ખરીદશું. પહોંચતું. સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.	151	જો તમોએ ખરીદયું હોયતો તારથી જણાવો.
141	ખરીદશું. પહોંચતું. સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.	152	જો બતાવેલી સંખ્યા મેળવી શકો તો જવાબ આપો.
142	ખરીદશું. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.	153	અમોએ ખરીદ કર્યું છે.
		154	બતાવેલા ભાવોમાં આના પાણુ વગરની સંખ્યાએ ખરીદ કર્યું છે.
		155	મળી શકે એવી આશા નથી.

143 ખરીદશું. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ. દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

144 ખરીદશું. પહોંચતું. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી છ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

145 ખરીદશું. પહોંચતું. સી આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ. તે. ડીલીવરી મળ્યા બાદ એક મહીને નાણું આપવાની શરતે.

146 ખરીદશું. માસ ૧ પછી ડીલીવરી લેવાની શરતે.

147 ખરીદશું. માસ ૩ ની છુટી ડીલીવરી. દર મહીને સરખે ભાગે લેવાની શરતે.

148 ખરીદશું. ડીલીવરી બાદ એક મહીને નાણું આપવાની શરતે.

156 મળી શકશે એવી આશા છે.

157 હજુ ખરીદ થાય છે.

158 જણાવેલ આશામી ખરીદ કરે છે.

159 ખરીદ થયું છે.

160 બતાવેલા ભાવોમાં આના પાણુ વગરની સંખ્યાએ ખરીદ થયું છે.

161 કેટલું મળી શકશે. બતાવેલા ભાવે.

162 જણાવેલ આશામીએ કેટલું અને શું ભાવે ખરીદ્યું હશે તે જણાવો.

163 જણાવેલ આશામીને હજુ કેટલું ખરીદવું છે તે જણાવો.

164 જણાવેલ આશામોની ખરીદી ચાલુ છે.

165 જણાવેલ આશામીની ખરીદી બંધ છે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
166	ખરીદાવીએ તો કેટલું અને શું ભાવે મેળવી શકો.	184	
167	બતાવેલા ભાવે. બતાવેલી સંખ્યા પુરી પાડી શકીએ. જો ખરીદવા હુકમ લખો તો.	185	વેચો (વેચાણ કરો).
		186	વેચો બતાવેલા ભાવે ખરીદદાર હોય તો.
168	બતાવેલા ભાવે તમોને જોઇશે તેટલું મળી શકશે.	187	વેચો બતાવેલા ભાવોમાં આના પાણુ વગરની સંખ્યાએ ખરીદદાર હોય તો.
169	તમારે કેટલુંક ખરીદવા વીચાર છે.		
170	લીલામ થશે તો અમો ખરીદ કરવા લખીશું.	188	વેચો. જો પોશાણુ જાણો તો.
171	લીલામવાળો માલ તમારે ખરીદવો નહીં.	189	વેચો. જણાવેલી સરતે.
172	સદરહુ માલ ખરીદવા જેવું છે.	190	વેચો. અગાઉની સરતે.

173 તમારે ખરીદી ચાલુ રાખવી.

174 ખરીદી બંધ રાખો.

175

176

177

178

179

180

181

182

183

191 વેચો. આગળના જેવું.

192 વેચો. આવતું અથવા જણાવેલા બારકસનું

193 વેચો જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનુ

194 વેચો. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે.

195 વેચો. જણાવેલા માસમાં ડીલીવરી આપવાની સરતે.

196 વેચો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે.

197 વેચો. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે તો પણ વખતસર ડીલીવરી નહીં કરીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

198 વેચો. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે તો પણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
199	વેચ્યો. જણાવેલા માસમાં ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.	209	વેચ્યો. પોહોચતું સી. આઇ. એફ હારબર જણાવેલા મહીનાથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
200	વેચ્યો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપતા રહીએ.	210	વેચ્યો. ડીલીવરી સાથે નાણા લેવાની સરતે.
		211	વેચ્યો. લીલામ કરીને.
		212	વેચ્યો. લીલામમાંથી ખરીદેલ તે.
201	વેચ્યો. પોહોચતું કીનારા ઉપર ડીલીવરી આપવાની સરતે.	213	વેચ્યો. ખરીદ કરી રાખેલ છે તે.
		214	વેચ્યો. જણાવેલ આસામીને.
202	વેચ્યો. બારકસની લૉંગસાઇડમાં પોહોચતું આપીએ.	215	વેચ્યો. ડીલીવરી બાદ એક મહીને નાણા લેવાની સરતે.

203 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

204 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

205 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ

206 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

207 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી ચાર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

208 વેચો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી પાંચ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

216 વેચો. ડીલીવરી બાદ બે મહીને નાણુ લેવાની સરતે.

217 વેચો. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણુ લેવાની સરતે.

218 **વેચાવો.** (જણાવેલા પોર્ટમાં અથવા આસામી મારફત.)

219 વેચાવો. બતાવેલા ભાવે વેચી શકે તો.

220 વેચાવો. બતાવેલી સંખ્યાએ નેકાશ કરી શકેતો.

221 વેચાવો. બતાવેલા ભાવોમાં આનાપાણ વગરની સંખ્યાએ. વેચી શકે તો.

222 વેચાવો. જો પોસાણ જાણો તો.

223 વેચાવો. આવતું અથવા જણાવેલા બારકસનું.

224 વેચાવો. જણાવેલી સરતે.

225 વેચાવો. અગાઉની સરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).
226	વેચાવો. આગગના જેવું.
227	વેચાવો. જણાવેલા તોલ માપ અથવા મારકામેકરનું
228	વેચાવો. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે.
229	વેચાવો. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે.
230	વેચાવો. જણાવેલા માસમાં ડીલીવરી આપવાની સરતે.
231	વેચાવો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે.
239	વેચાવો. ડીલીવરી બાદ એક મહીને નાણા લેવાની સરતે.
240	વેચાવો. ડીલીવરી બાદ બે મહીને નાણા લેવાની સરતે.
241	વેચાવો. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણા લેવાની સરતે.
242	વેચાવો માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે તે પણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકશાની આપી છુટીએ.

232 વેચાવો. પોહોચતું ડીનારે ડીલીવરી આપવાની સરતે.

233 વેચાવો. બારકસની લૅાંગસાઇડમાં પોહોચાડી આપવાની સરતે.

234 વેચાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

235 વેચાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

236 વેચાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

237 વેચાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

238 વેચાવો. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

243 વેચાવો. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપી છુટીએ.

244 વેચાવો. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપતા રહીએ.

245 **વેચીએ.** (વેચાણ કરીએ.)

246 વેચીએ બતાવેલા ભાવે.

247 વેચીએ. બતાવેલા ભાવોમાં આનાપાણ વગરની સંખ્યાએ.

248 વેચીએ. ઉધડું બતાવેલી સંખ્યાએ.

249 વેચીએ. જણાવેલ આશામીને.

250 વેચીએ. જણાવેલી સરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧-૨-૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
251	વેચીએ. અગાઉની સરતે.	266	વેચીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.
252	વેચીએ આગળના જેવું.	267	વેચીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
253	વેચીએ. આવતું અથવા જણાવેલા બારકસનું.	268	વેચીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
254	વેચીએ. જણાવેલા તોલ માપ અથવા મારકામેકરનું.	269	વેચીએ. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપીએ.
255	વેચીએ. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે.		
256	વેચીએ. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે.		
257	વેચીએ. જણાવેલા માસમાં ડીલીવરી આપવાની સરતે.		

258 વેચીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે.

259 વેચીએ. ડીલીવરી બાદ એક મહીને નાણા મળવાની સરતે.

260 વેચીએ. ડીલીવરી બાદ બે મહીને નાણા મળવાની સરતે.

261 વેચીએ. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદતસર નાણા મળવાની સરતે.

262 વેચીએ. પોહોચતું કીનારે ડીલીવરી આપવાની સરતે

263 વેચીએ. બારકસની લૉંગસાઇડમાં પોહોચાડી આપવાની સરતે.

264 વેચીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

265 વેચીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

270 વેચીએ. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપીએ.

271 વેચીએ. જણાવેલ માસમાં ડીલીવરી આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપીએ.

272 વેચીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે તોપણ જો વખતસર ડીલીવરી નહી કરીએ તો જણાવેલા ભાવે નુકસાની આપતા રહીએ.

273 વેચીએ. લીલામ કરીને.

274 વેચીએ. લીલામમાંથી ખરીદેલ છે તે.

275 વેચીએ. ખરીદેલ બારોબાર.

276 વેચાવીએ. (જણાવેલા પોર્ટમાં અથવા આસામી મારફત.)

ફોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સ્વાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
277	વેચાવીએ. બતાવેલા ભાવે.	292	વેચાવીએ. ડીલીવરી બાદ ગામના રીવાજ પ્રમાણે મુદ્દતસર નાણા મળવાની સરતે.
278	વેચાવીએ. બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ.	293	વેચાવીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.
279	વેચાવીએ. ઉધડું બતાવેલી સંખ્યાએ.	294	વેચાવીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.
280	વેચાવીએ. જણાવેલી સરતે.	295	વેચાવીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.
281	વેચાવીએ. અગાઉની સરતે.	296	વેચાવીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.
282	વેચાવીએ. આગળના જેવું.		
283	વેચાવીએ. જો હુકમ આપો તો.		

284 વેચાવીએ આવતું અથવા જણાવેલા બારકસનું.

285 વેચાવીએ. જણુવેલા તોલ માપ અથવા મારકા-
મેકરનું.

286 વેચાવીએ. માસ ૧ પછી ડીલીવરી આપવાની સરતે

287 વેચાવીએ. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે.

288 વેચાવીએ જણાવેલા મહીનામાં ડીલીવરી આપ-
વાની સરતે.

289 વેચાવીએ. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને
સરખે ભાગે આપવાની સરતે.

290 વેચાવીએ. ડીલીવરી બાદ એક મહીને નાણા મલ-
વાની સરતે.

291 વેચાવીએ. ડીલીવરી બાદ બે મહીને નાણા મળ-
વાની સરતે.

297 વેચાવીએ. પોહોચતું સી. આઇ. એફ. હારબર જ-
ણાવેલા માસથી છ શીપમેન્ટ દર મહીને સરખે
ભાગે શીપમેન્ટ.

298 વેચાવીએ. લીલામ કરાવીને.

299 વેચાવીએ. લીલામમાં ખરીદાવેલ તે.

300 વેચાવીએ. ખરીદાવેલ તે.

301 વેચીશું (વેચાણ કરીશું.)

302 વેચીસું. તમારા હુકમ મુજબ.

303 વેચીશું. બતાવેલા ભાવે.

304 વેચીશું. બતાવેલા ભાવોમાં અંનાપાણ વગરની
સંખ્યાએ.

305 વેચીશું. જણાવેલ આસામીને

306 વેચીશું જણાવેલી સરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર)
307	વેચીશું. અગાઉની સરતે.	321	વેચીશું. જણાવેલ મહીનામાં ડીલીવરી આપવાની સરતે.
308	વેચીશું. આગળના જેવું.	322	વેચીશું. માસ ૩ ની છુટી ડીલીવરી દર મહીને સરખે ભાગે આપવાની સરતે.
309	વેચીશું. બારકસની લૅાંગસાઇડમાં પોહોચતું.	323	કેટલું વેચાયું તે તારથી જણાવો.
310	વેચીશું. લીલામ કરીને.	324	જો વેચાયું હોય તો જવાબ આપો.
311	વેચીશું. લીલામમાંથી ખરીદેલું તે.	325	શું ભાવે તમો વેચી શકસો જવાબ આપો.
312	વેચીશું. આવતું અથવા જણાવેલા બારકસનું.	326	બતાવેલા ભાવે કેટલુંક વેચી શકશો.
313	વેચીશું. જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનું.		

314 વેચીશું. પોહોચતુ સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

315 વેચીશું. પોહોચતું સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

316 વેચીશું. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

317 વેચીશું. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

318 વેચીશું. પોહોચતું સી. આઇ. એફ. હારબર જણાવેલા મહીનાથી છ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે શીપમેન્ટ.

319 વેચીશું. માસ ૧ પછી ડીલીવરી આપવાની શરતે.

320 વેચીશું. માસ ૨ પછી ડીલીવરી આપવાની સરતે.

327 બતાવેલી સંખ્યા તમોથી નેકાશ થઇ શકશે.

328 તમારા હુકમ મુજબ વેચી ખલાસ કર્યું છે.

329 હજુ વેચાયું નથી.

330 હાલ વેચાય એવી આશા જણાતી નથી.

331 જો વેચવું હશે તો હાલ નેકાશ થઇ જશે.

332 તમારે કેટલુંક વેચવું છે.

333 બતાવવામાં આવેલી સંખ્યા આશરે અમારે વેચવું છે.

334 વેચાણ ચાલુ રાખો.

335 વેચાણ બંધ રાખો.

336 વેચાણ ચાલુ રાખ્યું છે.

337 વેચાણ બંધ રાખ્યું છે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર)
338	જણાવેલ આશામી વેચે છે.	354	શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ચાર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
339	જણાવેલ આશામી વેચશે.	355	શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી પાંચ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
340	આવતું વેચી ખલાસ કર્યું છે.	356	શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
341	વેચીને તારથી જવાબ આપો.	357	વેચીશું. તમોને. સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.
342	ઑફર આપો (માગણી કરો) બતાવેલા ભાવે વેચશે.		
343	ઑફર માગો. બતાવેલા ભાવે ખરીદશે.		
344	શું ભાવે તમારે વેચવું છે.		

345 શું ભાવે તમારે ખરીદવું છે.

346 અમારે હાલ વેચવા વિચાર નથી.

347 અમારે હાલ ખરીદવા વીચાર નથી.

348 જો તમારે વેચવું હશે તો અમો ખરીદશું.

349 જો તમારે ખરીદવું હેશે તો અમો વેચીશું.

350 શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

351 શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

352 શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

353 શું ભાવે વેચશો સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

358 વેચીશું. તમોને સી. આઇ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

359 વેચીશું. તમોને સી. આઈ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

360 વેચીશું. તમોને સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

361 વેચીશું. તમોને સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ચાર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

362 વેચીશું. તમોને સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી પાંચ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

363 વેચીશું. તમોને સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
364	શું ભાવે તમો ખરીદશો.	375	ખરીદશું તમો પાસેથી સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
365	શું ભાવે તમો ખરીદશો. સી. આઈ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.	376	ખરીદશું તમો પાસેથી સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ચાર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
366	શું ભાવે તમો ખરીદશો. સી. આઈ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.	377	ખરીદશું તમો પાસેથી સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી પાંચ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
367	શું ભાવે તમો ખરીદશો. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.	378	ખરીદશું તમો પાસેથી સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી છ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ
368	શું ભાવે તમો ખરીદશો. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ		

369 શું ભાવે તમો ખરીદશો. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ચ ર શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

370 શું ભાવે તમો ખરીદશો. સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી પાંચ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

371 શું ભાવે તમો ખરીદશો. સી. આઈ. એફ. હારબર જણાવેલા માસથી ૭ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે. સીપમેન્ટ

372 ખરીદશું તમો પાસેથી. સી. આઈ. એફ. હારબર ચાલુ માસની શીપમેન્ટ.

373 ખરીદશું તમો પાસેથી સી. આઈ. એફ. હારબર આવતા માસની શીપમેન્ટ.

374 ખરીદશું તમો પાસેથી સી. આઇ. એફ. હારબર જણાવેલા માસની શીપમેન્ટ.

379 બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ ખરીદશો તો તમોને અમો વેચીશું સી. આઈ. એફ. હારબરની સરતે.

380 બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ વેચશો તો તમો પાસેથી અમો ખરીદ કરશું સી. આઈ. એફ. હારબરની સરતે.

381 તમારા ટેલીગ્રાફ મુજબ શોદો અમો કબુલ રાખીએ છીએ.

382 તમારા કાગળ મુજબ શોદો અમો કબુલ રાખીએ છીએ.

383 તમોને અમોએ આપવું કર્યું છે તમારા છેલ્લા ટેલીગ્રાફ મુજબ તે અમારે કબુલ છે.

384 તમોને અમોએ આપવું કર્યું છે તમારા છેલ્લા કાગળ મુજબ તે અમારે કબુલ છે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
385	તમો પાસેથી અમોએ લેવું કર્યું છે તમારા છેલ્લા ટેલીગ્રાફ મુજબ તે અમારે કબુલ છે.	397	તમો પાસેથી ખરીદેલ માલનો શોદો અમો કેનસલ કરી શકતા નથી.
386	તમો પાસેથી અમોએ લેવું કર્યું છે તમારા છેલ્લા કાગળ મુજબ તે અમારે કબુલ છે.	398	તમોને વેચેલ માલનો શોદો અમો કેનસલ કરી શકતા નથી.
387	સી. આઈ. એફ. હારબરની સરતે અમોએ તમો પાસેથી લેવું કર્યું છે.	399	તમો પાસેથી ખરીદેલા માલનો શોદો અમોએ કેન-સલ કીધો છે.
388	સી. આઈ. એફ. હારબરની સરતે અમોએ તમોને આપવું કર્યું છે.	400	તમોને વેચેલ માલનો શોદો અમોએ કેનસલ કીધો છે.
389	ચાલતા માસની શીપમેન્ટનો માલ પેહેલા બારકસ-માં શીપમેન્ટ કરજો.	401	તમો પાસેથી ખરીદેલો માલ જો તમો ખરીદશો તો બતાવેલા ભાવે તમોને વેચીશું

390 ચાલતા માસની શીપમેન્ટનો માલ બીજા બારકસ-
માં શીપમેન્ટ કરજો.

391 ચાલતા માસની શીપમેન્ટનો માલ છેલ્લા બારકસ-
માં શીપમેન્ટ કરજો.

392 ચાલતા માસની શીપમેન્ટનો માલ તમોને અમો
તરફથી બીજો જવાબ મળ્યા લગણુ રોકત કરજો.

393 ચાલતા માસની શીપમેન્ટનો માલ આવતા માસમાં
શીપમેન્ટ થાય તેમ કરજો.

394 આવતા માસની શીપમેન્ટનો માલ ચાલતા માસમાં
જેમ તરત શીપમેન્ટ થાય તેમ કરો.

395 તમો પાસેથી ખરીદેલા માલનો શોદો જો કેનસલ
થઈ શકે તો કેનસલ કરો.

396 તમોને વેચેલ માલનો શોદો જો કેનસલ થઈ શકે
તો કેનસલ કરો.

402 તમોને વેચેલ માલ જો તમો વેચશો તો અમો
તમો પાસેથી બતાવેલા ભાવે ખરીદશું.

403

404

405

406

407

408

409

410 ચડાવો (સીપમેન્ટ કરો) પેહેલી જોગવાઇએ.

411 ચડાવો. તૈયાર બારકસમાં લાગુ કરી શકો તો.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
412	ચડાવો. જણાવેલા બારકસમાં લાગુ કરી શકો તો.	429	ચડાવો. પાલો કરીને.
413	ચડાવો. મંડાયલા બારકસમાં ઑાડર મલે તો.	430	ચડાવો જોટા બંધાવીને.
414	ચડાવો. બતાવેલા ભાવનો ખરીદ કરીને.	431	ચડાવો. બંડલ બંધાવીને.
415	ચડાવો. બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ ખરીદ કરીને.	432	ચડાવો. કરંડીઆ ભરાવીને.
416	ચડાવો. જો બતાવેલા ભાવે વેચવું પોશાણુ જાણોતો.	433	ચડાવો. જો નમુના પ્રમાણે માલ હોયતો.
417	ચડાવો. જણાવેલી શરતે.	434	ચડાવો. બંદર પરથી પરભારૂં ટ્રાન્શીપ કરીને.
418	ચડાવો. અગાઉની શરતે.	435	ચડાવો. અને વળતો જવાબ તારથી આપો.

419 ચડાવો. આગળના જેવું.

420 ચડાવો. જો ઘરમાં બાલાંશ હોયતો.

421 ચડાવો. લીલામમાંથી ખરીદેલ ઘરમાં બાલાંશ હોયતો.

422 ચડાવો. જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનું

423 ચડાવો. ગમે તેમ કરી બનતી કોશીશે.

424 ચડાવો. જણાવેલા પોર્ટથી મંગાવીને.

425 ચડાવો. ઉપર બીજે બારદાન ચડાવીને.

426 ચડાવો. બારદાન બદલાવીને.

427 ચડાવો. નવા બારદાનમાં ભરીને.

428 ચડાવો. સેકન્ડહેન્ડ બારદાનમાં ભરીને.

436 ચડાવો. અને હુંડી ડૅાકયુમેન્ટ લખો.

437 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૧૦ ની લખો.

438 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૧૫ ની લખો.

439 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૨૨ ની લખો.

440 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૩૦ ની લખો.

441 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૪૫ ની લખો.

442 ચડાવો. અને ડૅાકયુમેન્ટ હુંડી દીન ૬૦ ની લખો.

443 ચડાવો. અને હુંડી પ્લેન દીન ચાર ચારની લખો.

444 ચડાવો. અને હુંડી પ્લેન દીન ૧૫ ની લખો.

445 ચડાવો. અને હુંડી પ્લેન દીન ૩૧ ની લખો.

446 ચડાવો. અને હુંડી પ્લેન દીન ૪૧ ની લખો.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
447	ચડાવો અને પ્લેન હુંડી દીન ૫૧ ની લખો.	462	ચડત કરાવો. જણાવેલી શરતે.
448	ચડાવો અને પ્લેન હુંડી દીન ૬૧ ની લખો.	463	ચડત કરાવો. અગાઉની શરતે.
449	ચડાવો. અને પ્લેન હુંડી દીન ૭૧ ની લખો.	464	ચડત કરાવો. આગળના જેવું.
450	ચડાવો. અને પ્લેન હુંડી દીન ૯૦ ની લખો.	465	ચડત કરાવો. બતાવેલા ભાવે વેચવું પોશાણુ જાણો તો.
451	ચડાવો. અને હુંડી (હવાલા) લખો.	466	ચડત કરાવો. જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરતું.
452	ચડાવો. અને ઓચરીઆ જણાવેલા આશામીને સોંપી અવેજ તેનણુ પાસેથી લ્યો.	467	ચડત કરાવો. ગમે તેમ કરી બનતી કોશીશે.
		468	ચડત કરાવો. જો નમુના પ્રમાણે માલ હોયતો.

453 **ચડાવો.** અને તે પેટે અવેજ નગદીમાં રવાના કીધો છે.

454 ચડાવો અને તે પેટે અવેજ કાગળમાં બીડયો છે.

455 ચડાવો અને અવેજ માટે કાગળમાં ખુલાસો અમોએ લખ્યું છે.

456 **ચડત કરાવો** (જણાવેલા પોર્ટથી અથવા આશામી મારફત).

457 ચડત કરાવો. જો બારકસ તૈયાર હોયતો.

458 ચડત કરાવો. જો બારકસ મંડાયું હોયતો.

459 ચડત કરાવો બતાવેલા ભાવનો ખરીદાવીને.

460• ચડત કરાવો બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ ખરીદાવીને.

461 ચડત કરાવો. જો સ્પીંગ ઑરડર મેળવી શકે તો.

469 ચડત કરાવો અને વળતો જવાબ તારથી આપો

470 **ચડાવીએ** (સીપમેન્ટ કરીએ)

471 ચડાવીએ. બારકસ તૈયાર છે.

472 ચડાવીએ. બારકસ મંડાયું છે.

473 ચડાવીએ. જણાવેલા બારકસમાં.

474 ચડાવીએ બતાવેલા ભાવે ઑરડર લઇને.

475 ચડાવીએ. બતાવેલા ભાવનો.

476 ચડાવીએ. બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ ખરીદ કરીને.

477 ચડાવીએ. જણાવેલા તોલ માપ અથવા મારકા મેકરનું.

478 ચડાવીએ. જણાવેલા પોર્ટથી મંગાવીને.

479 ચડાવીએ. જણાવેલાં શરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
480	ચડાવીએ. અગાઉની શરતે.	499	ચડત કરાવીએ. આગળના જેવું.
481	ચડાવીએ આગળના જેવું.	500	ચડત કરાવીએ. જો પોશણ જાણેતો.
482	ચડાવીએ. ઘરમાં બાલાંશ છે તેમાંથી.	501	ચડત કરાવીએ જણાવેલા મારગે ટ્રાન્શીપ.
483	ચડાવીએ તમોને નમુનો મુકેલ તેવું.	502	ચડત કરાવીએ જણાવેલા તોલ માપ અથવા મા-રકામેકરનું.
484	ચડાવીએ. જો તમો તરફ ચાલે તો.	503	ચડત કરાવીએ નમુના પ્રમાણે.
485	ચડાવીએ. જણાવેલા મારગે ટ્રાન્શીપ.	504	ચડત કરાવીએ જો તમો તરફ ચાલે તો.
486	ચડાવીએ. જો. પોશાણ જાણેતો.	505	ચડત કરાવીએ બંડલ બંધાવીને.
487	ચડાવીએ. લીલામમાંથી ખરીદેલ છે તે.		

488 ચડાવીએ. બારદાન બદલાવીને.

489 ચડાવીએ. બંડલ બંધાવીને.

490 ચડાવીએ. કરંડીઆ ભરાવીને.

491 ચડાવીએ. બંદર પરથી પરભારૂં ટ્રાન્શીપ કરીને.

492 ચડત કરાવીએ (જણાવેલા પોર્ટથી અથવા આશામી મારફત)

493 ચડત કરાવીએ. બારકસ તૈયાર છે.

494 ચડત કરાવીએ. બારકસ મંડાયું છે.

495 ચડત કરાવીએ. બતાવેલા ભાવનો.

496 ચડત કરાવીએ. બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ.

497 ચડત કરાવીએ જણાવેલી શરતે.

498 ચડત કરાવીએ. અગાઊની શરતે.

506 ચડત કરાવીએ બારદાન બદલાવીને.

507 ચડત કરાવીએ કરંડીઆ ભરાવીને.

508 ચડાવીશું (ચડત કરીશું.)

509 ચડાવીશું જણાવેલા બારકસમાં.

510 ચડાવીશું બારકસના જોગે.

511 ચડાવીશું બતાવેલા ભાવે ઓર્ડર મળશે તો.

512 ચડાવીશું બતાવેલા ભાવે મળશે તો.

513 ચડાવીશું બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ મળશે તો.

514 ચડાવીશું જણાવેલા મારગે ટ્રાન્સીપ.

515 ચડાવીશું તમો તરફથી અવેજ મળેથી.

516 ચડાવીશું જણાવેલી સરતે.

517 ચડાવીશું અગાઉની સરતે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
518	ચડાવીશું આગળના જેવું.	535	ચડત કરાવીશું. જણાવેલી સરતે.
519	ચડાવીશું જણાવેલા તોલ માપ અથવા માર-કામેકરનું.	536	ચડત કરાવીશું. અગાઉની સરતે.
520	ચડાવીશું. તમારા હુકમ મુજબ.	537	ચડત કરાવીશું. આગળના જેવું.
521	ચડાવીશું. તમોને મુકેલ નમુના મુજબ.	538	ચડત કરાવીશું. જણાવેલા તોલ માપ અથવા માર-કામેકરનું.
522	ચડાવીશું. ઘરમાં બાલાંશ છે તેમાંથી.	539	ચડત કરાવીશું. જો ઘરમાં બાલાંસ હશે તો.
523	ચડાવીશું. બારદાન બદલાવીને.	540	ચડત કરાવીશું. બારદાન બદલાવીને.
524	ચડાવીશું. બંડળ બંધાવીને.	541	જો ચડયું હોય તો જવાબ આપો.

525 ચડાવીશું. કરંડીઆ ભરાવીને.

526 **ચડત કરાવીશું.** (જણાવેલા પોર્ટથી અથવા આસામી મારફત.)

527 ચડત કરાવીશું. જણાવેલા બારકસમાં.

528 ચડત કરાવીશું, બતાવેલા ભાવે ઓર્ડર મળશે તો.

529 ચડત કરાવીશું. બતાવેલા ભાવનો.

530 ચડત કરાવીશું. બતાવેલા ભાવોમાં આનાપાણુ વગરની સંખ્યાએ

531 ચડત કરાવીશું. જણાવેલા મારગે ટ્રાન્શીપ,

532 ચડત કરાવીશું. તમો તરફથી અવેજ મળેથી.

533 ચડત કરાવીશું નમુના મુજબ.

534 ચડત કરાવીશું. તમારા હુકમ મુજબ.

542 જો ચડી શકે તો જવાબ આપો.

543 ચડી ગયું છે.

544 ચડી ગયું છે અને બાકી ચડવાનું છે.

545 ચડી ગયું છે અને બાકી ચડવાનું છે તે પણ ચડી જવા વકી છે.

546 ચડી ગયું છે અને બાકી ચડવાનું છે તે સટાઉટ થવા વકી છે.

547 હજું ચડયું નથી.

548 ચડી જાય એવી આશા જણાતી નથી.

549 ચડી જવા વકી છે.

550 ચડતનો જોર કેવો છે.

551 ચડતનો જોર વીશેસ (ગણું) છે.

552 આહુાના માટે કુલ્લે કેટલુંક ચડત થશે.

કોલમ (૧) પહેલું ત્રણુ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર)
553	આંહીના માટે કુલ્લે કેટલુંક ચડત થયું હશે.	570	બારકસ મંડાયાની ખબર આપે.
554	બતાવેલી સંખ્યા આશરે ચડત થશે.	571	જો બારકસ મંડાયું હોય તો ખબર આપો.
555	બતાવેલી સંખ્યા આશરે ચડયું હશે.	572	બારકસ કયારે મંડાશે તેની ખબર આપો.
556	હજુ ચડત થાય છે.	573	બારકસ હાલ તરતમાં મંડાય તેવો ભરોસો નથી.
557	હજુ ચડત કરે છે.	574	બારકસ મંડાયાની વાતચીત ચાલે છે.
558	જણુાવેલા પોર્ટનો માલ ચડી જશે.	575	બારકસ હજુ મંડાયું નથી.
559	જણુાવેલા પોર્ટનો માલ ચડવા ભરોસો નથી.	576	બારકસ મંડાયું છે.

560 જણાવેલા પોર્ટનો માલ ચડી જશે પણ છેલે જ-
ણાવેલા પોર્ટનો માલ ચડવા ભરોસો નથી.

561

562

563

564

565

566

567

568

569

577 બારકસ જણાવેલી તારીખે માલ લેવો શુરુ કરશે.

578 બારકસ હજુ માલ ઉપાડે છે.

579 બારકસ જણાવેલી તારીખે અથવા મહીને ઉપડશે.

580 બારકસ માલ ઉપાડશે નહી.

581 બારકસ માલ ઉતારે છે.

582 બારકસ માલ ઉપાડશે પણ જણાવેલા પોર્ટમાં ટ્રા-
ન્શીપ કરશે.

583 બારકસ ફકત જણાવેલા પોર્ટનો માલ ઉપાડશે.

584 બારકસ તરતમાં ઉપડવા વકી છે.

585 બારકસ આવતી કાલે ઉપડશે.

586 બારકસ ગઈ કાલે ઉપડી ગયું છે.

587 બારકસ જણાવેલી તારીખે ઉપડી ગયું છે.

588 બારકસ જણાવેલી તારીખે ઉપડશે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
589	બારકસે માલ સટાઉટ કર્યું છે.	607	મંડાયલો બારકસ કેનસલ થયો છે.
590	બારકસ માલ ઉતાર્યા વિના ઉપડી ગયું છે.	608	બારકસ ફક્ત ટ્રાન્શીપ માલ ઉપાડશે.
591	બારકસ ફરતી વેળા માલ ઉતારશે.	609	બારકસ ફક્ત આગળનો સટાઉટ માલ ઉપાડશે.
592	બારકસ ખાલી પાસીંજર ઉપાડશે.	610	બારકસ ટઈ દેશાવડ જશે.
593	બારકસ પાસીંજર ઉપાડશે નહીં.	611	બારકસ જણાવેલી દેશાવડ તરફ જશે.
594	બારકસને કવારાનટાઇન થઇ છે.	612	બારકસ જણાવેલા મારગે થઇને જશે.
595	બારકસની સલામતી માટે ભય છે.	613	બારકસ જણાવેલા મારગે થઇને આવશે.
596	બારકસ હજુ પોહોચ્યું નથી.	614	બારકસ કયા મારગે થઇને જશે.

597 બારકસ સહીસલામત પોહોચ્યું છે.

598 બારકસ તોફાન ખાઈ પોહોચ્યું છે.

599 બારકસ ક્યાં છે તેની ખબર આપો.

600 બારકસ ક્યાં છે તેની ખબર નથી.

601 બારકસ સહીસલામત પોહોચ્યું હોય તો ખબ-
ર આપો.

602 બારકસ વીશે તમોને જે કાંઈ ખબર મળી હોય તે
અમોને જણાવો.

603 બારકસ વીશે અમોને કાંઈ પણ સમાચાર મળ્યા નથી.

604 બારકસ માલ ડામીમ ઉતારે છે.

605 બારકસે લીધેલો માલ પાછો ખાલી કરે છે.

606 બારકસમાં કામ નીકળવાથી હાલ તરતમાં ઉપ-
ડશે નહીં.

615 બારકસ કયા મારગે થઇને આવશે.

616 બારકસને જે પુરતો માલ મળશે તો મંડાશે.

617 બારકસ ચારટર મળી શકે તો ખબર આપો.

618 બારકસ ચારટર મળી શકશે. હુકમ આપો તો
કરીએ.

619 બારકસ ચારટર મળે તો કરો.

620 બારકસ ચારટર મળશે તો કરશું.

621 બારકસ હાલ ચારટર મળે તેમ નથી.

622 બારકસ હાલ ચારટર કરવું નહી.

623 બારકસ જણાવેલી સરતે ચારટર કરવું.

624 બારકસ અગાઉની સરતે ચારટર કરવું.

625 બારકસ ચારટર કરવાની તજવીજમાં છીએ.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
626	બારકસ ચારટર કર્યું છે.	644	જણાવેલ આસામીની બદલી રવાના થયો છે.
627	બારકસ હજુ ચારટર કર્યું નથી.	645	મેનેજરની બદલી રવાના થયો છે.
628	બારકસ ચારટર કરો જો જણાવેલી સંખ્યા પાસીંજરોની આપણી વતી ઉપાડે તો.	646	જણાવેલ આસામી રહેમતે ખુદા પોહોચ્યો (સ્વર્ગવાસ થયો.) (દેવ થયો.)
629	બારકસ ચારટર મળે છે પણ પાસીંજર પોતાની તરફથી ઉપાડશે.	647	મેનેજર રહેમતે ખુદા પોહોચ્યો. (સ્વર્ગવાસ થયો) (દેવ થયો.)
630	બારકસ ચારટર કર્યું છે. સાથે પાસીંજર આપણી વતી જણાવેલી સંખ્યા ઉપાડશે.	648	જણાવેલ આસામીની તબીયત બગડતી જાય છે.
631	બારકસ ચારટર કર્યું છે તેની સરત બતાવેલો ભાવ માલના નોલનો અને જણાવેલો ભાવ પાસીંજરોના નોલનો.	649	મેનેજરની તબીઅત બગડતી જાય છે.
		650	જણાવેલ આસામીની સલામતી માટે જાય છે.

632 બારકસમાં અમારા કુટુમ્બને રવાના કીધા છે.

633 બારકસમાં અમો કુટુમ્બ સહીત રવાના થાશું.

634 બારકસમાં જણાવેલ આસામી રવાના થયો છે.

635 બારકસમાં અમારા કુટુમ્બને રવાના કરો.

636 બારકસમાં જણાવેલ આસામીને રવાના કરો.

637 બારકસમાં તમારો કુટુમ્બ રવાના થશે.

638 બારકસમાં જણાવેલ આસામી રવાના થશે.

639 બારકસમાં તમારો કુટુમ્બ રવાના થયા છે.

640 બારકસમાં શેઠ પોતે રવાના થશે.

641 બારકસમાં શેઠ પોતે રવાના થયા છે.

642 જણાવેલ આસામીની બદલી મોકલો.

643 મેનેજરની બદલી મોકલો.

651 જણાવેલ આસામી પોતાની હયાતીમાં તમોને મળવા ઇનતેજાર છે માટે તરત આવો.

652 જણાવેલ આસામીને હયાતીમાં મળવું હોય તો તરત આવે.

653 જણાવેલ આસામીની તબીયત કેમ છે.

654 જણાવેલ આસામી તનદુરસ્ત હાલનમાં છે.

655 દેખત તાર તરત રવાના થાઓ.

656 જણાવેલ આસામીને ધરપીરપ કરવી નહી.

657 જણાવેલ આસામી પાસે લેણું હોય તો તરત વસુલ કરી લેવું.

658 જણાવેલ આસામી સાથે સાવચેતીથી લેતીદેતી કરવી.

659 જણાવેલ આસામી કાચી પડી છે. દેવું કેટલું તે હજુ જણાયું નથી.

કોલમ (૧) પહેલું ત્રણું અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
660	આસામી કાચી પડી છે બતાવેલી સંખ્યા દેવું છે.	668	તમારો તાર મળ્યો પણ સમજી શકયા નથી.
661	આસામી કાચી પડી છે બતાવેલી સંખ્યા દેવું છે જ્યારે ભાવના માટે બતાવવામાં આવેલ સંખ્યાઓમાંથી આનાપાણુ વગરની સંખ્યા તે આપણો અથવા છેલે જણાવેલ આસામીનું લેણું સમજવું.	669	અમારા તારનો અમલ ન કર્યો હોય તો આ સાથે જણાવ્યા મુજબ કરો.
662	આસામી કાચી પડી છે બતાવેલી સંખ્યા ઉપર મીંડુ રાખીને દેવું સમજવું જ્યારે ભાવના માટે બતાવવામાં આવેલ સંખ્યાઓમાંથી આનાપાણુ વગરની સંખ્યા તે આપણો અથવા છેલે જણાવેલ આસામીનું લેહેણું સમજવું.	670	અમારા તારનો અમલ ન કર્યો હોય તો હવે તે તારને રદબાતલ સમજો.
		671	અમારા કાગળનો જવાબ તાર મારફત માગેલ હતો પણ જવાબ હજુ મળ્યો નહી.
		672	તમારા કાગળ મુજબ કામ કર્યું છે.

663 આસામી કાચી પડી છે બતાવેલી સંખ્યા ઉપર મીંડુ રાખીને દેવું સમજવું જ્યારે ભાવના માટે બતાવવામાં આવેલ સંખ્યાઓમાંથી આનાપાણુ વગરની સંખ્યા ઉપર મીંડુ રાખીને આપણો અથવા છેલે જણાવેલ આસામીનું લેહેણું સમજવું.

664 આસામી કાચી પડી છે બતાવેલી સંખ્યા દેવું છે જ્યારે ભાવના માટે બતાવવામાં આવેલ સંખ્યાઓમાંથી આનાપાણુ વગરની સંખ્યા ઉપર મીંડુ રાખીને આપણો અથવા છેલે જણાવેલ આસામીનું લેહેણું સમજવું.

665 અમારા તારનું અમલ કર્યું કે કેમ.

666 અમારા તારનું જવાબ હજુ કર્યું નહી.

667 તમારો તાર અમોને મળ્યો નથી.

673 તમારા કાગળ મુજબ કામ થશે નહી.

674 તમારા કાગળ મુજબ કામની તજવીજમાં છીએ.

675 દરેક ખુલાસો તમોને મેલમાં લખશું.

676 દરેક ખુલાસો તમોને મેલમાં લખ્યો છે.

677 તમારો તાર મળ્યો આ સાથે જણાવ્યા મુજબ મતલબ સમજ્યા છીએ તો તે કામની તજવીજમાં છીએ.

678 તમારો તાર મળ્યો આ સાથે જણાવ્યા મુજબ મતલબ સમજ્યા છીએ તો તે કામ બનવા ભરોસો નથી.

679 તમારા તાર મુજબ કામ કર્યું છે.

680 મેલ આવ્યો પણ કાગળ હજુ મળ્યા નથી.

કોલમ (૧) પહેલું ત્રણુ અંકી નંબરોનું ૧-૨-૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).
681	કાગળ મળ્યા પણુ અવેજ નીકળ્યો નહીં.
682	મેલમાં કાગળ લાગુ થઇ શક્યા નહીં.
683	અવેજ ઓચર વગરનો કાગળ બીડેલ છે.
684	મેલમાં બતાવેલ સંખ્યાની હુંડી હવાલા ચેક વગેરે અવેજ સહીત કાગળ બીડયો છે.
685	મેલમાં બતાવેલ સંખ્યાની હુંડી હવાલા ચેક વગેરે અવેજ અને જણુાવેલ ઓચર સહીત કાગળ બીડયો છે.

નંબર.	(પર્ટીક્યુલર).
695	તમો તરફના ભાવ અને રૂખ જણુાવો.
696	તમો તરફના ભાવ અને સ્ટૉક જણુાવો.
697	તમો પાસે કેટલું બાલાંસ છે અને ભાવ શું છે.
698	બતાવેલો ભાવ હાલ ચાલે છે અને બતાવેલ સંખ્યા અમો પાસે બાલાંસ છે.
699	બતાવેલ ભાવ હાલ ચાલે છે અને બતાવેલ સંખ્યા આશરે ગામમાં સ્ટૉક છે.
700	બતાવેલ ભાવ હાલ ટકેલા છે.

686 બતાવેલ સંખ્યાના ચેકો સહીત કાગળ બીડેલ છે માટે જણાવેલ બેંક અથવા આસામીને ખબર આપો જે શીકરી જાય નહી.

687 ગેરવલે ગયેલ કાગળ મળ્યો કે કેમ.

688 ગેરવલે ગયેલ કાગળ હજુ મળ્યો નથી.

689 ગેરવલે ગયેલ કાગળ મળ્યો છે.

690 ગેરવલે ગયેલ કાગળના અવેજની ડુપલીકેટો અથવા પેઠો મોકલો.

691 મેલ જોડે કાગળ મળ્યા નથી માટે જો અવેજ બીડેલ હોય તો ડુપલીકેટો અને પેઠો મોકલો.

692 જણાવેલા ઓચર ગુમ થઈ ગયા છે.

693 જણાવેલ ઓચરની ડુપલીકેટ મોકલો.

694 તમો તરફ ભાવ શું છે તે જણાવો.

701 રૂખ જોતાં હાલ લાંબી વધઘટ થવા સંભવ નથી.

702 રૂખ જોતાં ભાવ હાલ વધવા સંભવ નથી.

703 રૂખ જોતાં ભાવ હાલ ઘટવા સંભવ નથી.

704 રૂખ જોતાં ભાવ વધવા વકી છે.

705 રૂખ જોતાં ભાવ ઘટવા સંભવ છે.

706 ભાવ અથર બજાર ઢંગધડા વગરની છે. તર્ક બાંધી શકાય તેમ નથી.

707 અસલ મથકે ભાવ વધેલાના સમાચાર અત્રે ફરી વળ્યા છે.

708 અસલ મથકે ભાવ ઘટી ગયાના સમાચાર ફરી વળ્યા છે.

709 ઓચીન્તુ ભાવ વધી જવાનો કારણ જણાવો.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર.)
710	આચીન્તુ ભાવ ઘટી જવાનું કારણુ જણાવો.	729	વરસાદની અતીશય ખેંચ છે.
711	આવક કેવી છે તે જણાવો. (આયાત.)	730	વરસાદ થવાના કાંઈ પણ ચિન્હ જણાતા નથી.
712	ઉઠાવ કેવો છે તે જણાવો. (નેકાશ.)	731	વરસાદ અતીશય પડે છે જેથી ટાઢા દુષ્કાળનો ભય રહે છે.
713	આવક વધુ પ્રમાણુમાં છે.	732	વરસાદની હવે જરૂર જણાતી નથી.
714	આવક બીલકુલ જુજ છે.	733	વરસાદ થોડો થોડો એકાદ એવાર પડી જાય તો વરસ આબાદ થાય.
715	આયાત બીલકુલ બંધ છે.	734	પાકની સ્થીતી જણાવો.
716	ઉઠાવ મોટો જથાબંધ ચાલે છે.	735	પાક શ્રીકાર ઉતરવા વકી છે.
717	ઉઠાવ બીલકુલ જુજ છે.		

718 ઉઠાવ બીલકુલ નથી.

719 હાલમાં એકદમ અછત છે.

720 હાલમાં સ્ટૉક વધુ પ્રમાણમાં છે.

721 બતાવેલ ભાવ વીશે જણાવેલ દેશાવરવાળાને અથ-
વા આસામીને ખબર આપો.

722 વરસાદના સમાચાર જણાવો.

723 વરસાદની શરૂવાત થઈ ચુકી છે.

724 વરસાદ પડવાં કરે છે. (ચાલુ છે.)

725 વરસાદ શ્રીકાર થયો છે. (વરસ આબાદ.)

726 વરસાદ થયાનાં ચિન્હ જણાય છે.

727 વરસાદ થયાના સમાચાર ફરી વળ્યા છે.

728 વરસાદની હજુ શરૂવાત થઇ નથી.

736 પાક કેવો ઉતરશે તે હજુ જણાયું નથી.

737 પાક કેવો ઉતરશે તે હજુ જણાયું નથી તોપણ
વરસ આબાદ (સોલ આના સમજવું.)

738 પાણીની તંગીના લીધે પાકની સ્થીતી ઘણીજ ન-
બળી સંભળાય છે.

739 પાક કેવો ઉતરશે તે હજુ જણાયું નથી તોપણ
નબળી સ્થીતી સમજવી.

740 પાક લગભગ પોણો ઉતરવા વકી છે.

741 પાક લગભગ અડધીઆણ ઉતરવા વકી છે.

742 દુષ્કાળ (દયાજનક સ્થીતી)

743 હાલ બજારમાં નાણાની ભીડ ઘણી ચાલે છે.

744 બજારમાં અધીરપ ઘણી વધી પડી છે.

745 હાલ અમોને અવેજ ભીડ ઘણીજ છે.

કોલમ (૧) પહેલું ત્રાણુ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
746	અવેજ ટેલીગ્રાફ મારફત અપાવો.	763	ધી. રૂપેસી બેંકમાંથી લ્યો.
747	તમોથી જેટલું બની શકે તેટલું અવેજ પેહેલા મેલમાં મોકલો.	764	ધી. બેંગાળ બેંકમાંથી લ્યો.
748	અમારા ઉપર હુંડી લખીને અવેજ તાર મારફત અપાવો.	765	ધી. હંગકોંગ એન્ડ સેંગાહી બેંકમાંથી લ્યો.
749	ટેલીગ્રાફ મારફત પોસ્ટલ મનીઓરડર કરો.	766	ધી. ચેકોહ માં બેંકમાંથી લ્યો.
750	દેખત તાર પોસ્ટલ મનીઓરડર કરો.	767	ધી. મુંબઇ બેંકમાંથી લ્યો.
751	અવેજ નગદીમાં રવાના કરો.	768	ધી. આગ્રા બેંકમાંથી લ્યો.
		769	અમો પાસે હાલ અવેજ તૈયાર નથી.
		770	અમારાથી હાલ અવેજ મોકલવું બનસે નહી.

752 જો અવેજ મોકલવામાં આળસ કરશો તો અમોને બહુ મુજવણુ થશે.

753 દેવું છે. (ભરવું છે)

754 લેહેણું છે. (ઊગરાણી છે)

755 મેલમાં અવેજ બીડયો છે.

756 અવેજ નગદીમાં રવાના કર્યો છે.

757 જણાવેલ આશામી પાસેથી લ્યો.

758 જણાવેલ બેંકમાંથી લ્યો.

759 ધી. નેશનલ બેંક ઓફ. ઇન્ડીઆ લી. માંથી લ્યો

760 ધી. ફ્રેન્ચ બેંકમાંથી લ્યો.

761 ધી. કમરસીઅલ બેંકમાંથી લ્યો.

762 ધી. મારકન્ટાઇલ બેંકમાંથી લ્યો.

771 હુંડીનો હાલ કોઇ ખરીદનાર છે નહી.

772 હુંડી લખી છે ભરવાની તજવીજ રાખજો.

773 હુંડી લખવી નહોતી. હવે ભરવાને ટાંકણે અવેજ તાર મારફત અપાવજો.

774 અવેજ નગદીમાં રવાના કરશું.

775 અમોએ આંહી અવેજની તજવીજ કરી લીધી છે માટે હવે તમારે મોકલવું નહી.

776 જણાવેલા અવેજનો કબજો સોંપીને લ્યો (મેળવો)

777 જણાવેલા અવેજનો કબજો લઇને આપો.

778 હુંડી ઉપર જણાવેલ આશામીનો ઍંડાજ (સહી) મેળવીને વેચો.

779 જણાવેલ આશામીનો ઍંડાજ (સહી) મેળવો.

780 જણાવેલ આશામી ઍંડાજ (સહી) કરતા નથી.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર).
781	જણાવેલ આશામી હુંડી કાઢી નાંખે છે.	798	ડીલીવરી આપવા ઇનકાર કરે છે.
782	જણાવેલ આશામીએ ઍંડાજ (સહી) કરી આપી છે.	799	ડીલીવરી લેવા માટે ઇનકાર કરે છે.
783	જણાવેલ આશામીએ હુંડી ભરી આપી છે.	800	તમોએ ડીલીવરી આપવું નહી.
784	અમો હુંડી ભરશું નહી.	801	તમોએ ડીલીવરી લેવું નહી.
785	અમો હુંડી સહી કરશું નહી.	802	અમો ડીલીવરી આપીએ.
786	અમોએ હુંડી ભરી આપી છે.	803	અમો ડીલીવરી લઇએ.
787	તમોએ હુંડી ભરી દેવી.	804	અમો ડીલીવરી આપશુ નહી.
		805	અમો ડીલીવરી લઇશું નહી.

788 તમોએ હુંડી સહી કરી આપવી.

789 તમોએ હુંડી કાઢી નાંખવી.

790 અમોએ હુંડી સહી કરી આપી છે.

791 જણાવેલ આશામી પાસે લેણું છે.

792 જણાવેલ આશામીને ભરો.

793 જણાવેલ બેંકમાં ભરો.

794 **આપો ડીલીવરી.**

795 મેળવો ડીલીવરી.

796 અપાવો ડીલીવરી.

797 અપાવો ડીલીવરી તમો તરફના એજંટ મારફત અત્રેના એ. ટ પાસેથી.

806 ડીલીવરી આપી દીધુ છે.

807 ડીલીવરી લઇ લીધું છે.

808 હજુ ડીલીવરી આપ્યું નથી.

809 હજુ ડીલીવરી લીધું નથી.

810 ગેરન્ટી આપી ડીલીવરી લ્યો.

811 ગેરન્ટી લઇ ડીલીવરી આપો.

812 ગેરન્ટી ઉપર ડીલીવરી મળતું નથી.

813 ગેરન્ટી ઉપર ડીલીવરી મળશે.

814 જણાવેલી શરતે ડીલીવરી આપવું.

815 જણાવેલી શરતે ડીલીવરી લેવું.

816 ડીપાઝીટ ભરસું તો ડીલીવરી મળશે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર)
817	ડીપાઝીટ વગર ડીલીવરી આપશે તો લેવું.	837	કુલ્લે વજન બતાવેલી સંખ્યા બંગાલી મણોની થઇ છે.
818	ડીપાઝીટ ભરીને ડીલીવરી લ્યો.	838	કુલ્લે વજન બતાવેલી સંખ્યા મુંબઇના મણોની થઈ છે.
819	ડીલીવરી લેવા માટે ડીપાઝીટ ભરવું પડયું છે.	839	કુલ્લે વજન બતાવેલી સંખ્યા રતલોની થઈ છે.
820	ડીપાઝીટ લઇને ડીલીવરી આપ્યુ છે.	840	કુલ્લે વજન બતાવેલી સંખ્યા ટનોની થઇ છે.
821	જનરલ અવરેજ ભરવા વગર ડીલીવરી મળશે નહી	841	દરેક દાગીનાનો શરેરાશ વજન આશરે રતલ બતાવેલી સંખ્યા સમજવી.
822	જનરલ અવરેજ લેવા વગર ડીલીવરી આપવું નહી	842	મ.લ તરત ઊંચકી લેવું.
823	નુકશાની લઇને ડીલીવરી આપવું.		
824	નુકશાની આપવા વગર ડીલીવરી મળશે નહી.		

825 નુકશાની લેવા વગર ડીલીવરી આપશું નહી.

826 ચુકતે હીસાબ લઇને ડીલીવરી આપવું.

827 ચુકતે હીસાબ આપવા વગર ડીલીવરી મળશે નહી

828 માલ ઢામીચ ઉતરે છે.

829 માલ નમુના પ્રમાણે નથી.

830 માલમાં વજન ગાટી ઘણી દેખાય છે.

831 માલમાં ફાટટુટ ઘણી છે.

832 સરવઇ કરાવ્યા વગર ડીલીવરી લેવું નહી.

833 વજન કરાવ્યા વગર ડીલીવરી લેવું નહી.

834 સરવઇ કરાવ્યા વગર ડીલીવરી લેશે નહી.

835 વજન કરી આપવા વગર ડીલીવરી લેશે નહી.

836 કુલ્લે વજન બતાવેલી સંખ્યા. હુનરવેટોની થઈ છે.

843 માલ વેર હાઉસ જવા દેવું નહી.

844 માલ વેર હાઉસ કરજો.

845 માલ બહુ રાશી છે. (ખરાબ)

846 માલ ટાટોબર છે ઓછે અદકે વેચવા વગર તરત નેકાશ થશે નહી.

847 તોલ ગાટી વેવારે મજરે આપવી.

848 તોલ ગાટી વેવારે મજરે લેવી.

849 માલનો નમુનો મોકલો (સેંમ્પલ)

850 માલનો નમુનો મોકલીએ.

851 માલનો નમુનો મુકેલ છે તમોં તરફ ચાલશે કે કેમ.

852 માલ નમુના પ્રમાણે હશે તો ચાલશે.

કોલમ (૧) પહેલું ત્રણુ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
853	તમોએ મુકેલ નમુનાનો માલ અહીં ચાલતો નથી માટે મોકલતા ના.	869	જણાવેલ આસામી લીલામ કરી વેચશે.
854	લાગી ગયેલ બારકશનું માલ લીલામ થવાનું છે.	870	લીલામ થવાનો માલ સારી સ્થીતીમાં છે.
855	લીલામ થવાનું છે તે અમોએ લેવું કે કેમ.	871	લીલામમાં બતાવેલી સંખ્યા સુધી બીટ (ઑફર) આપવી.
856	લીલામ થવાનું છે તે અમો ખરીદશું.	872	ડામીસ માલ લીલામ કરીને વેચો.
857	જણાવેલ આસામીએ લીલામમાંથી ખરીદયું છે.	873	બતાવેલા ભાવે શોદો નીકળ્યો છે.
858	લીલામમાંથી અમોએ ખરીદયું છે.	874	અમોએ લેવાનું સારું કર્યું છે.
		875	અમોએ વેચવાનું સારું કર્યું છે.

859 જણાવેલા આશામીએ લીલામમાંથી ખરીદેલ તે પાસેથી અમોએ લીધું છે.

860 લીલામનો માલ તમોએ ખરીદવું નહી.

861 લીલામનો માલ અમો ખરીદશું નહી.

862 જો લીલામ થાય તો તમોએ ખરીદવું.

863 લીલામ થવાનું છે જો તમારે ખરીદવા વીચાર હોય તો તરત આવો.

864 લીલામ થવાનું છે માલ ખરીદવા જેવું છે સારો લાભ મળવા ઉમેદ છે.

865 લીલામમાં માલ બહુ ઓછી કીમતે જાય છે.

866 લીલામમાં માલની બહુ સારી કીમત ઉપજે છે.

867 લીલામનો માલ તમોએ ખરીદયો છે કે કેમ.

868 લીલામનો માલ અમોએ ખરીદયો નથી.

876 અમોએ લેવાનું સાટું કર્યું છે તમોએ ભાગ રાખવું હોય તો જવાબ આપો.

877 અમોએ વેચવાનું સાટું કર્યું છે તમોએ ભાગ રાખવો હોય તો જવાબ આપો.

878 બતાવેલા ભાવે શોદો નીકળેથી ખબર આપજો.

879 જો તમો લેવાનો શોદો કરો તો અમારો ભાગ રાખજો.

880 જો તમો વેચવાનો સાટો કરો તો અમારો ભાગ રાખજો.

881 અમોએ લેવાનું સાટું કર્યું છે જેમાં તમારો ભાગ રાખ્યો છે.

882 અમોએ વેચવાનું સાટું કર્યું છે જેમાં તમારો ભાગ રાખ્યો છે.

883 જો અમો સરો શોદો કરશું તો તમારો ભાગ રાખશું.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).
884	જો તમારે સાટા શોદામાં અમારા સાથે ભાગ રાખવો હોય તો અગાઉથી તમોએ અમોને ખબર કરવી.
885	તમોએ કરેલ શોદામાં અમારો ભાગ રાખજો.
886	અમોએ કરેલ શોદામાં તમારો ભાગ રાખ્યો છે.
887	અમોએ કરેલ શોદામાં તમારો ભાગ રાખી શકતા નથી.
883	હાલ અમારે શોદો કરવા વીચાર નથી.

નંબર.	(પર્ટીકયુલર).
897	જણાવેલ આસામીને બીલકુલ વેચવું નહી.
898	કંટરાકટ બાંધો.
899	સપ્લાઈ કરવા માટેનો કંટરાકટ ક્યારે બાહાર પડશે.
900	સપ્લાઈ કરવા માટેનો કંટરાકટ બાહાર પડશે.
901	કંટરાકટના ટેન્ડર લેવાશે.
902	સપ્લાઈ કરવા માટેનો કંટરાકટ બાંધશું.
903	સપ્લાઇ કરવા માટેનો કંટરાકટ બાંધવા વીચાર હોય તો જણાવો.

889 હાલ અમારે કાંઈ પણ સાટા શોદામાં ભાગ રાખ-
વા વીચાર નથી.

890 અમોએ વેચાણ કાઢ્યું છે.

891 જણાવેલ આસામી પાસેથી માગણી કરી પણ તે
આપવા રાજી નથી.

892 જણાવેલ આસામીએ અમો પાસેથી માગણી કરી
પણ અમો આપવા રાજી થયા નહી.

893 જણાવેલ આસામી પાસેથી અમો માગણી કરીએ.

894 જણાવેલ આસામી વેચે તોજ લેવું.

895 જણાવેલ આસામી ખરીદદાર હોય તો બીજાને નહી
વેચતાં તેઓનેજ વેચવું.

896 જણાવેલ આસામી પાસેથી બીલકુલ હોય પણ
ભાવે લેવું નહી.

904 સદરહુ કંટરાકટનું જાહેર લીલામ થશે.

905 સદરહુ કંટરાકટ કેટલી મુદત સુધી સપ્લાઇ કરવા
માટેનો બંધાશે.

906 સદરહુ કંટરાકટમાં કેટલોક સ્ટોક રાખવો પડશે.

907 સદરહુ કંટરાકટમાં કેટલોક અવેજ રોકવો પડશે.

903 સદરહુ કંટરાકટ ખાતે આશરે બનાવેલી સંખ્યાનો
સ્ટૉક બાલાંસ રાખવો પડશે.

909 સદરહુ કંટરાકટ ખાતે આશરે બતાવેલી સંખ્યા
અવેજની રોકત થશે.

910 સદરહુ કંટરાકટ કોના નામ ઉપર ગયો.

911 સદરહુ કંટરાકટ આપણા નામે આવ્યો છે.

912 સદરહુ કંટરાકટ જણાવેલ આસામીના નામે ગયોછે.

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર)
913	સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામી સાથે ભાગ રાખશું.	928	સદરહુ કંટરાકટના ટેન્ડર સાથે કેટલુંક ડીપાૅઝીટ ભરવું પડશે.
914	સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામીને પેટા ભાગીઓ રાખશું.	929	સદરહુ કંટરાકટના ટેન્ડરની શરતો જણાવો.
915	સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામી સાથે અમોએ ભાગ રાખ્યો છે.	930	સદરહુ કંટરાકટના ટેન્ડરની નકલ. અને શરતો લખી મોકલો.
916	સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામીને પેટા ભાગીઓ રાખ્યો છે.	931	જણાવેલી શરત કંટરાકટના ટેન્ડરમાં દાખલ કરવી
917	સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામીને ભાગીઓ રાખવો પડશે.	932	કંટરાકટની મુદત દરમ્યાન કેટલુંક માલ સપલાઇ કરવું પડશે.

918 સદરહુ કંટરાકટમાં કોઇને પણ ભાગીદાર કરવો નહી.

919 સદરહુ કંટરાકટમાં જણાવેલ આસામીને પેટા ભા-
ગીઓ રાખજો.

920 સદરહુ કંટરાકટમાં ભાગ મળી શકે તો રાખજો.

921 ઇમારત બાંધવાનો કંટરાકટ ક્યારે બાહાર પડશે.

922 ઇમારત બાંધવાના કંટરાકટના ટેન્ડર લેવાશે.

923 ઇમારત બાંધવાનો કામ કેટલી મુદત ચાલશે.

924 ઇમારતનો કામ જણાવેલી મુદત ચાલશે.

925 સદરહુ કંટરાકટમાં છ માસ સપ્લાઈ કરવું પડશે.

926 સદરહુ કંટરાકટમાં આખો વરસ સપ્લાઇ કરવું પડશે.

927 સદરહુ કંટરાકટના ટેન્ડર સાથે બતાવેલ સંખ્યા
ડીપાઝીટ ભરવું પડશે.

933 કંટરાકટની મુદત દરેમ્યાન બતાવેલ સંખ્યાનો
માલ સપલાઇ કરવું પડશે.

934 જો પુર પાડનાર મળશે તો કંટરાકટ બાંધી લેશું.

935 જો હમેશાં આપવા રાજી હશે તો કંટરાકટ બાંધી
લેશું બીજા કોઇને આપે નહી.

936 અમારા હીસાબે સ્પીંગ ઓરડર નોધાવી રાખજો.

937 અમારા હીસાબે પેસેજ ડેકની ટીકીટ નોધાવી રા-
ખજો.

938 અમારા હીસાબે પેસેજ ટીકીટ સેકન્ડકલાસની નો-
ધાવી રાખજો.

939 અમારા હીસાબે પેસેજ ટીકીટ ફર્સ્ટ કલાસની
નોધાવી રાખજો.

940 પ્રોટેસ્ટ કરાવો. (પટેશ)

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીકયુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીકયુલર).	નંબર.	(પર્ટીકયુલર).
941	પ્રોટેસ્ટ કરાવશું.	958	દાવાનો (કેસનો) આપણા લાભમાં ચુકાદો થયો છે.
942	પ્રોટેસ્ટ કરાવ્યું છે.	959	ઘરમેળે શેટલ થયું છે.
943	નોટીશ કરો.	960	રાજીનામું અપાયું જણાવેલી શરતે.
944	નોટીશ કરશું.	961	શેટલ થયું છે બતાવેલા ભાવે નુકસાનીથી.
945	નોટીશ કરી છે.	962	શેટલ થયું છે બતાવેલા ભાવે નફો. આપવાની શરતે.
946	જણાવેલ આશામી પ્રોટેસ્ટ કરાવશે	963	ઘરમેળે શેટલ થવાનો બંદોબસ્ત કરો.
947	જણાવેલ આશામીએ પ્રોટેસ્ટ કરાવ્યું છે.		

948 જણાવેલ આશામીએ નોટીશ કરી છે.

949 જણાવેલ આશામી નોટીશ કરશે.

950 ડેમરેજ (નુકસાની) નો કલેમ કરો.

951 ડેમરેજ (નુકસાની) કલેમ કીધો છે.

952 ડેમરેજ (નુકસાની) નો કલેમ કરશું.

953 દાવો (કેસ) નોંધાયું છે.

954 દાવો (કેસ) ચાલે છે.

955 દાવો (કેસ) મુલતવી રહયું છે.

956 દાવો (કેસ) ડીસમીસ થયું છે.

957 દાવાનો (કેસનું) જણાવેલ આશામીના લાભમાં ચુકાદો થઈ ગયો છે.

964 ધરમેળે શેટલ થવ.નો સંભવ નથી.

965 ધરમેડે શેટલ થઇ જશે.

966 ધરમેળે શેટલ કરવા બંદોબસ્ત કરશું.

967

968

969

970

971

972

973

કોલમ (૧) પહેલું ત્રણ અંકી નંબરોનું ૧—૨—૩

સવાલ જવાબોની પર્ટીક્યુલર (હકીકત) માટેનો પહેલો બીજો અને ત્રીજો અંક.

નંબર.	(પર્ટીક્યુલર).	નંબર.	(પર્ટીક્યુલર.)
974		991	
975		992	
976		993	
977		994	
978		995	
979		996	
980		997	

981
982
983
984
985
986
987
988
989
990

998
999
000

કોલમ (૨) બીજુ ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
001	• • • • ખાલી. (નકામું.)	019	ગીની મજીદી (ઉશમની)
002	સ્ટેટ. (મકાન) જાગીર.	020	ગીની ફ્રેન્ચ (ભેન્ચ).
003	અવેજ (નાણું.)	021	ગીની અમેરીકન.
004	સોનું (હેમ.)	022	ગીની મજીદીના પાવલા.
005	સોનું (ટચ ૧૦૦).	023	ગીની ફ્રેન્ચના પાવલા.
006	સોનું (ટચ ૧૦૦) નેશનલબેંકની લગડી.	024	ગીની અમેરીકનના પાવલા.
007	સોનું ટચ ૯૭.	025	ગીની રૂસીઅન.

008 સોનું ફેક્તું (અર્ગમાંથી કાઢેલું.)

009 સોનાની બાંગડી.

010 સોનાના તુસીપાટ.

011 સોનાની ઝરમર.

012 સોનાની હીરાસાંકલી.

013 સોનાની લાકીટ.

014 સોનાનો ચંદનહાર.

015 સોનાનો જુમણો.

016 સોનાનાં એરીંગ.

017 ગીની.

018 ગીની ઘોડાની.

026 ચાંદી.

027 ચાંદી ચીનાઈપાટની.

028 ચાંદી ગામડી. (શોધેલી.)

029 ચાંદી સાથે મેળવણીવાળું રૂપું.

030 ચાંદીના તોડા.

031 ચાંદીના પાઉંજેર.

032 ચાંદીના અડાસીઆ.

033 ચાંદીના કડલા.

034 ચાંદીના ઝાંઝર.

035 રૂપીઆ.

036 રૂપીઆ કલદાર.

037 રૂપીઆ ઝરમની.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
038	સીલીંગ (વેલાતની બાર પેની).	058	મોતી સફેત મગજ.
039	ફ્રાન્ક (૧૦૦ સીન્ટીનું).	059	મોતી પીલો મગજ.
040	ટેલ્ સેગાહી.	060	મોતી આસમાની મગજ.
041	કોરોની બશગાઇ.	061	મોતી સફેત બદલો.
042	ડૉલર.	062	મોતી સફેત ગાટના છડા.
043	રીઆલ વીતા ફ્રાન્શા.	063	મોતી સફેત બદલાના છડા.
044	રીઆલ મજીદી.		
045	રીઆલ ઉમલા (જીધામાં હીસાબનો).	064	મોતી આસમાની કાગાવાસી (વેરાતઅર).

046 રીઆલ મીસરી.

047 ઝવેરાત.

048 હીરા (સફેત.)

049 પાના (લીલા)

050 માણુક (રાતા)

051 **મોતી સાચાં.**

052 મોતી સફેત જીવન (વેલાતબર).

053 મોતી સફેત જીવનનો બદલો.

054 મોતી મીઠા જીવન.

055 મોતી મીઠા જીવનનો બદલો.

056 મોતી પીલો જીવન.

057 મોતી પીલા જીવનનો બદલો.

065 મોતી આરટ્રેલીઆ માટ.

066 મોતી આરટ્રેલીઆ હલકો.

067 **અમ્બર.**

068 **કસ્તુરી.**

069 **હાથીદાંત.**

070 હાથીદાંતના મોટા કટકા (વેલાતબર).

071 હાથીદાંત ખડવાર.

072 હાથીદાંત ધાભલા.

073 હાથીદાંત આકશા.

074 હાથીદાંત ચત્તા.

075 હાથીદાંત પોલા.

076 **વાહાણુ.**

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો	નંબર.	માલનાં નામો.
077	આગબોટ. (સ્ટીમર).	096	તીજોરી.
078	આસ્ટ્રેલીઆ લોયડસની સ્ટીમર.	097	તીજોરી ગામઠી.
079	આસીઆટીક લાઇનની સ્ટીમર.	098	તીજોરી વિલાયતી.
080	ઇટાલીઅના લાઇનની સ્ટીમર.	099	તીજોરી અમેરીકન.
081	જરમન (મેલ) લાઇનની સ્ટીમર.	100	ટ્રન્ક (સ્ટીલ) વિલાયતી ટ્રન્ક (લોખંડની પેટી.)
082	મેસાઝરી મારીટાઇમ (ફ્રેન્ચમેલ) લાઇનની સ્ટીમર.	101	ફરનીચર.
083	પી. એન્ડ. ઓ. કું. (મેલલાઇન)ની સ્ટીમર.	102	ખુરસી.
084	બ્રીટીશ ઇન્ડીઆ લાઇનની સ્ટીમર.	103	પલંગ.

085 બોમ્બે એન્ડ પરસીઆ (મુગલ) લાઇનની સ્ટીમર.

086 ઈજીપ્સીઅન (મેસરીમેલ) લાઇનની સ્ટીમર.

087 મે. કાવસજી દીનશાહ અને ભાઇઓની સ્ટીમર.

088 શેફર્ડ કું. (હાજીકાસમ) ની સ્ટીમર

089 અકસ્માતથી નુકસાન થયેલ સ્ટીમર.

090 મીલ.

091 મશીન (સંચો).

092 પ્રીન્ટીંગ પ્રેસ.

093 ટાઇપ રાઇટીંગ.

094 •કોપી છાપવાના પ્રેસ.

095 શીવવાના સાંચા.

104 ટેબલ.

105 કબાટ.

106 સ્કુત્રીપેટી પીતળની નકસીવાળી (મલબારી)

107 સ્કુત્રીપેટી સાગની (મુંબાઇની).

108 લાકડું

109 ખોડથી.

110 ખોડથી જાડી

111 ખોડથી ઝીણી

112 ખોડથી જંગ

113 બીમ.

114 બીમ ઝોખું.

કોલમ (૨)બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
115	બીમ વચરાશ.	133	ઘોડાગાડી લેન્ડો.
116	બીમ જાડા.	134	ઘોડાગાડી મેલકોચ.
117	પાટીઆ (તખ્તા.)	135	ઘોડાગાડીના ચાક.
118	પાટીઆં સીંગાપુરી	136	ગાડીના ચાક.
119	સીલીંગ સાગલી.	137	ગાડાના ચાક.
120	સીલીંગ દેવદારી.	138	મોટરકાર ગાડી.
121	લાકડું પાકો સાગ.	139	મોટરકાર બૉઇસીકલ.
		140	બાઇસીકલ (બે ચાકની).

122 લાકડું કાચો સાગ.

123 લાકડું દેવદાર.

124 લાકડું સીશમ.

125 લાકડું જંગલી.

126 ઘોડાગાડી.

127 ઘોડાગાડી વિક્ટોરીઆ.

128 ઘોડાગાડી સીગરામ.

129 ઘોડાગાડી બગી.

130 ઘોડાગાડી બ્રુમ.

131 ઘોડાગાડી ડૉકીઆટ

132 ઘોડાગાડી ટાંગો.

141 ટ્રાઇસીકલ (ત્રણ ચાકની).

142 હોડી માછીમારની એક લાકડાની.

143 હોડી માછીમારની એક લાકડાની નાની.

144 બગલો.

145 કોટીઓ.

146 રબર.

147 રબર ચાક ઉપર ચડાવવાનું.

148 ચુનો.

149 સ્મીટ.

150 કોલસા.

151 પથર.

152 પથર પોરબંદરી.

કૌલમ (૨) બીજુ ત્રણ અંકી નંબરોનુ ૪—૫—૬

માલના નામો માટેના ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
153	આરસપાહાણુ.	171	જશાવત. (જશત).
154	આરસપાહાણુની લાદી.	172	જશત પાટનું.
155	નલીઆ.	173	જશતનાં પતરાં.
156	નલીઆ વિલાયતી	174	જશત ભંગાર.
157	નલીઆ માંગલોરી.	175	પારો.
158	લોખંડ. (લોઢું.)	176	ત્રાંબુ (ત્તાંબુ).
159	લોખંડનાં પતરાં.	177	ત્રાંબુ પાટનું.
		178	ત્રાંબાનાં પતર

160 લોખંડના સળીઆ.

161 લોખંડ ભંગાર.

162 લોખંડ ઠામસના પાટા જાડા.

163 લોખંડ ઠામસના પાટા ઝીણા.

164 લોખંડ શેકાઇ (સુવેસી)ના પાટા જાડા.

165 લોખંડ શેકાઇ (સુવેસી)ના પાટા ઝીણા.

166 લોખંડ તીખું.

167 લોખંડ તીખું વિલાયતી જાડું.

168 લોખંડ તીખું વિલાયતી ઝીણું.

169 લોખંડ તીખું ગામઠી જાડું.

170 લોખંડ તીખું ગામઠી ઝીણું.

179 ત્રાંબાનું ભંગાર.

180 પીતલ.

181 પીતલ પાટનું.

182 પીતલનાં પતરાં.

183 પીતલ ભંગાર.

184 કલાઈ.

185 કલાઈ પાટની.

186 કલાઈ ગ.ળેલી. (ફારકા).

187 કાંસુ.

188 કાંસુ ભંગાર.

189 સીસું.

190 સીસું પાટનું.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
191	ટીનનાં પતરાં.	210	ચોખા પાકા હુડા.
192	ટીન પતરાની ગામઠી ટ્રન્કો (પેટીઓ).	211	ચોખા કાચા હુડા.
193	ટીન પતરાનાં રમકડાં.	212	ચોખા માંજા દાઉદખાની.
194	કાચ.	213	ચોખા માંજા દાઉદખાની ઉંચા. નં. ૧
195	કાચ બીલોરી જાડો.	214	ચોખા માંજા દાઉદખાની નંબર. ૨
196	માલ.	215	ચોખા માંજા દાઉદખાની હલકા.
197	અનાજ. (દાણા).	216	ચોખા માંજા દાઉદખાની જુના ઉંચા.
198	ચોખા (ચાવલ.)	217	ચોખા કોરા દાઉદખાની.

199 ચોખા રાડીં.

200 ચોખા રાડી વચરાશ ચલણી નંબર ૨.

201 ચોખા રાડી હલકા.

202 ચોખા રાડી કરાંચીના-

203 ચોખા બલમ.

204 ચોખા બલમ વચરાશ ચલણી નંબર ૨.

205 ચોખા બલમ જુના.

206 ચોખા બલમ કરાંચીના.

207 ચોખા સેકન્ડ બલમ કરાંચીના.

208 ચોખા કાઝલા.

209 ચોખા દેશી કાઝલા.

218 ચોખા ચીની શાકર.

219 ચોખા ચીની શાકર હલકા નંબર. ૨

220 ચોખા મુગી ઉંચા મોરીશબર.

221 ચોખા મુગી વચરાશ ચલણી મોરીશબર.

222 ચોખા ફ્લશ પેંટ.

223 ચોખા ચટ ગામ.

224 ચોખા કોકનાડા.

225 ચોખા રાતા સીંધી.

226 ચોખા પાકા.

227 ચોખા કાચા.

228 ચોખા શીંગાપુરી પાકા.

229 ચોખા શીંગાપુરી કાચા સફેત.

કોલમ (૨)બીજું ત્રણુ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
230	ચોખા રાશનના.	249	જુવારી કરાચીની.
231	ચોખા પોટકલી.	250	જુવારી પોર્ટ શોદાનની.
232	ચોખા કરાંચીના ખેરવાઈ.	251	જુવારી યમાની (ગર્બ) હોદેદાની.
233	ચોખા રંગુની હલવે..	252	જુવારી જુની ડંકવાલી.
234	ચોખા રંગુની મોટી મીલના.	253	બાજરો.
235	ચોખા રંગુની નાની મીલના.	254	બાજરો કરાંચીનો.
236	ચોખા રંગુની વાકર મીલના.	255	બાજરો મુંબઈનો.
237	ચોખા રંગુની કણી.		

238 ચોખાની શાર.

239 ચોખાની કણી (રૈયું)

240 **જુવારી.**

241 જુવારી સફેત.

242 જુવારી પીલી.

243 જુવારી રાતી.

244 જુવારી શોલાપુરી ઊંચી.

245 જુવારી શોલાપુરી વચરાશ ચક્ષણી.

246 જુવારી બંગાલી. (કલકતાની)

247 જુવારી રંગુની.

248 જુવારી બાહારાન.

256 બાજરો ઊંચો.

257 બાજરો હલકો.

258 **મકાઈ.**

259 **ગોધમ** (ગહું)

260 ગોધમ ખંડવો.

261 ગોધમ પીડીઆ.

262 ગોધમ કાઠા.

263 ગોધમ બન્શી.

264 ગોધમ ખપલા.

265 ગોધમ પીશી.

266 ગોધમ બશરાઈ.

267 ગોધમ કોણી.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
268	ગોધમ ઢોડી.	288	દાલ લાંગની જાડી.
269	જવ.	289	દાલ લાંગની ઝીણી.
270	જવ બસરાઈ.	290	તલદાણા.
271	જવ કરાંચીના.	291	તલદાણા સફેત.
272	જઈ.	292	તલદાણા કાબરા.
273	ગુવાર.	293	તલદાણા કાલા.
274	ચણા.	294	તલદાણા લાલ.
275	ચણા સફેત.	295	તલદાણા મીણબારો.

276 ચણા લાલ. (રાતા)

277 ચણા પીલા.

278 ચણા દીલ્હીના.

279 ચણા જંબુસરી.

280 મગ.

281 મસુર આખા છલટાવાલા.

282 મસુરના લાલ ગોટા.

283 દાલ.

284 દાલ ચણાની.

285 દાલ મસુરની.

286 દાલ મગની છડી.

287 દાલ તુવરની.

296 તલદાણા હાવરી સફેત.

297 તલદાણા કરાંચીના.

298 તલદાણા મુમ્બાઇના.

299 તલદાણા (યમાની) હોદેદા મોખાના

300 અલસી.

301 એરન્ડી.

302 સરસી.

303 શીંગદાણા (ભોઇસીંગના દાણા)

304 આટો.

305 આટો સુફરફાઇન મેદો.

306 આટો હવ શોહોલ્ડ મેદો.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
307	આટો એક્સપોર્ટ મેદો.	325	**આટો યુનીઅન મીલ** (ઉંટ છાપ).
308	આટો બજાર ફ્લૉવર.	326	અટો યુનીઅનમીલ (ઉંટ છાપ) સુફરફાઇન.
309	આટો શોપ.	327	આટો યુનીઅનમીલ (ઉંટ છાપ) હવશો હોલ્ડ.
310	આટો શોપ નંબર. ૨ જો.	328	આટો યુનીઅનમીલ (ઉંટ છાપ) એક્સ પોર્ટ.
311	આટો શોપ નંબર ૪ થો.	329	આટો યુનીઅનમીલ (ઉંટ છાપ) બજાર ફ્લૉવર.
312	આટો હવ શે.હોલ્ડ પાકીટો.	330	આટો યુનીઅનમીલ (ઉંટ છાપ) શોપ.
313	સોજી જાડી.	331	**આટો વાલેશ મીલ** (લંગર છાપ).
		332	આટો વાલેશ મીલ (લંગર છાપ) સુફરફાઇન.

314 સોજી જીણી.

315 નશાસ્તો.

316 આરારૂટ સફેત નંબર ૧ પેહેલો.

317 આરારૂટ સફેત નંબર ૨ બીજો.

318 ભુસો રતલ ૧૪૦ વાળી ગુની.

319 **આટો મુંબઇ ફ્લૉવર મીલ** (હાથીછાપ).

320 આટો મુંબઇ ફ્લૉવરમીલ (હાથીછાપ) સુફરફાઇન.

321 આટો મુંબઈ ફ્લૉવરમીલ (હાથીછાપ) હવશોહોલ્ડ.

322 આટો મુંબઈ ફ્લૉવરમીલ (હાથીછાપ) એકસપોર્ટ.

323 આટો મુંબઇ ફ્લૉવર મીલ (હાથી છાપ) બજા-
ર ફ્લૉવર.

324 આટો મુંબઈ ફ્લાવર મીલ (હાથી છાપ) શોપ.

333 આટો વાલેશ મીલ (લંગર છાપ) હવશોહોલ્ડ.

334 આટો વાલેશ મીલ (લંગર છાપ) એકસ પોર્ટ.

335 આટો વાલેશ મીલ (લંગર છાપ) બજાર ફ્લૉવર.

336 આટો વાલેશ મીલ (લંગર છાપ) શોપ.

337 **આટો કરાંચી સીંધ ફ્લૉવર મીલ હવશોહોલ્ડ.**

338 આટો કરાંચી નસરવાનજી મીલ હવશોહોલ્ડ.

339 આટો કરાંચી સંચરી મીલ હવશોહોલ્ડ.

340 આટો કરાંચી ઇન્ડીઆ મીલ હવશોહોલ્ડ.

341 આટો કરાચી શીકારપુર મીલ હવશોહોલ્ડ.

342 આટો અમદાવાદ મીલ હવશોહોલ્ડ.

343 આટો આગ્રામીલ હવશોહોલ્ડ.

344 આટો કાનપુરમીલ હવશોહોલ્ડ.

કોલમ (૨)બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો	નંબર.	માલનાં નામો.
345	આટો હાવરા મીલ હવશોહોલ્ડ. (કલકત્તા)	363	ખાંડ સાકરી દાણાદાર.
346	આટો કલકતા મીલ હવશોહોલ્ડ.	364	ખાંડ સફેત મોટો દાણો.
347	રસકસ (નીછટ) પરચુરણ ખોરાકી સામાન.	365	ખાંડ-સફેત દાણાદાર નંબર ૧ લો.
348	ચોપસુકર (ટેબ્લેટસ).	366	ખાંડ સફેત દાણાદાર નંબર ૨ જો.
349	ચોપસુકર કીલો ૫૦) વાળી પેટી.	367	ખાંડ સફેત દાણાદાર મોરેશી ઉંચી.
350	ચોપસુકર કીલો ૨૫) વાળી પેટી.	368	ખાંડ સફેત દાણાદાર મોરેશી નંબર ૨ જો.
351	લોફ સુકર (સુકરરાશ)-	369	ખાંડ સફેત દાણાદાર જાવી.
352	લોફ સુગર કીલો ૧૦૦) વાળી પેટી.		

353 લોફ સુગર કીલો ૯૦ વાલી પેટી ઝેડ. કે. ઝેડ. લાલ લેબલ.

354 લોફ સુગર કીલો ૯૦ વાળી પેટી. એલ. ઝેડ. આર. લાલ લેબલ.

355 લોફ સુગર કીલો ૯૦ વાળી પેટી કાળી ટીકીટ.

356 લોફ સુગર કીલો ૮૫ વાળી પેટી.

357 **ખડી શાકર (મીસરી).**

358 ખડી શાકર સફેત અસલ પતરીની.

359 ખડી શાકર સફેત ગામઠી.

360 ખડી શાકર પીળી ગામઠી.

361 ખડી શાકર લાલ દોમની.

362 ખડી શાકર સફેત પતરીની ગામઠી.

370 ખાંડ સફેત દાણાદાર જરમન.

371 ખાંડ સફેત દાણાદાર રશીઅન.

372 ખાંડ સફેત દાણાદાર (વિલાયતી) આસ્ટ્રેલીઅન. બી. આર. બી. અથવા તેને લગતી.

373 ખાંડ સફેત દાણાદાર ચીનાઇ

374 ખાંડ દાણાદાર પંચરાસી ભેલ્સેલ મોરેશી.

375 **ખાંડ લીસી સફેત મેંદા.**

376 ખાંડ લીસી સફેત નંબર ૧ લો.

377 ખાંડ લીસી સફેત નંબર ૨ જો.

378 ખાંડ લીસી સફેત મોરેશી.

379 ખાંડ લીશી સફેત જાવી.

380 ખાંડ લીશી સફેત ચીનાઇ દાબોટાની.

કોલમ (૨) બીજું ત્રણુ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
381	ખાંડ લીશી સફેત ચીનાઇ. સી. ડબલ્યુ.	400	ખજુર ફડધ.
382	ખાંડ લીશી સફેત ચીનાઇ A III.	401	ખજુર સામરાન વાહાણુ (બગલા) ની.
383	ખાંડ લીશી પીળી સોનેરી.	402	ખજુર સામરાન આગબોટની.
384	ખાંડ લીશી લાલ (રાતી ખાંડ.)	403	ખજુરનો શીરો.
385	ખાંડનો શીરો પાતળો.	404	ખારેક.
386	ગોળ.	405	સુકો મેવો.
387	ગોળ રવા અસલી.	406	કીશમીશ.
388	ગોળ બનાવટી રવા.	407	જડદાલુ.

389 ગોળ વેલુરના ચાકળા.

390 ગોળ મધરાસી ચાકળા.

391 ગોળ મલબારી ચાકળા.

392 ગોળ બનાવટી ચાકળા.

393 ગોળ શીંગાપુરી છલા.

394 ગોળ પીનાંગના છલા.

395 ખજુર.

396 ખજુર સામરાન.

397 ખજુર હલાવી.

398 ખજુર જાયદી.

399 ખજુર ઘેરી.

408 તાજો મેવો.

409 કેરી હાપુસ.

410 પાન નાગરવેલના.

411 પાન નાગરવેલના સુકાં મલબારી.

412 અનેનાસ.

413 અનેનાશ સીલેશ (કાપેલા) રતલ ૨ વાળા.

414 અનેનાશ સીલેશ (કાપેલા) રતલ ૧॥। વાળા.

415 અનેનાશ સીલેશ (કાપેલા) રતલ ૧॥ વાળા.

416 અનેનાશ આખા રતલ ૨ વાળા.

417 અનેનાશ આખા રતલ ૧॥। વાળા.

418 અનેનાશ આખા રતલ ૧॥ વાળા.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
419	**મુરબ્બો.**	437	નારીએલ પાણીચાં.
420	મુરબ્બો જીંજરનો.	438	નાળીએર ગુદગડા-
421	**દુધ વિલાયતી ડબાનું.**	439	નારીએલનાં સુકાં ટોપરાં.
422	સેવ વિલાયતી મેંદાના આટાની.	440	**ગ્રથ (ઘી).**
423	**પીપરમીટ.**	441	ઘી દેશી ઉંચું.
424	પીપરમીટની ગોળીઓ.	442	ઘી ગરાઉ ઉંચું.
425	પીપરમીટની ટીકડીઓ.	443	ઘી બેલોરી.
		444	ઘી બરબરી.

426 મધમાંખ.

427 મધમાંખ દેશી.

428 મધમાંખ એદનની (દોઆન.)

429 મધમાંખ તાયફની.

430 બદામ.

431 બદામ ઝીણી.

432 બદામનો મગજ.

433 પીસ્તાં.

434 પીસ્તાં છલટાવાળાં.

435 ચારોળી.

436 નારીએલ (શ્રીફળ.)

445 ઘી હરેરી.

446 ઘી બનાદેરી.

447 ઘી બનાવટી.

448 તેલ.

449 તેલ મીઠું.

450 તેલ ખોપરેલ.

451 તેલ એરન્ડીનું.

452 તેલ સુખડનું.

453 તેલ સુગંધી ફુલેલ.

454 અત્તર.

455 ગાસલેટ (પેતરોલ) ૧૨૫ ડીગ્રી.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪–૫–૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
456	ગાસલેટ અમેરીકન ૧૨૫ ડીગ્રી.	475	તંબાકુ વચરાશ (વસ્તાની).
457	ગાસલેટ રસીઅન ૧૨૫ ડીગ્રી.	476	તંબાકુ ફતની.
458	ગાસલેટ બાટુમ ૧૨૫ ડીગ્રી.	477	તંબાકુ નાની જુડીની.
459	ગાસલેટ ૧૫૦ ડીગ્રી.	478	તંબાકુ પાટલા.
460	ગાસલેટ ૧૫૦ ડીગ્રી (ફુલ છાપ).	479	તંબાકુ હમુમી.
461	કાંદા (ડુંગરી.)	480	તંબાકુ ગુડાકું.
462	બટાટા.	481	તંબાકુ બંગાળી ગુડાકું.
463	લસણ.		

464 **નીમક** (મીઠું).

465 નીમક પીસેલો.

466 **ભોઇસીંગ.**

467 ભોઇસીંગ જંગબારી જાડી.

468 **જનાવરોનીખોરાક.**

469 ઘાસ જનાવરોને ખાવાનું.

470 કડબી.

471 ખોળ (ખલી).

472 કપાસીઆ.

473 **તંબાકુ.**

474 તંબાકુ સુંઘણી.

482 તંબાકુ દેશાણુ.

483 તંબાકુ સીગરેટની.

484 તંબાકુ કાતરવાની સીગરેટના માટે.

485 **બીડીના પત્તાં** (ટેમ્બરના).

486 ગુંદર.

487 ગુંદર માખરી.

488 ગુંદર બરબરી.

489 ગુંદર સ્વાકીમનું (સોદાની).

490 **હીરાબોર.**

491 **બેસાબોર.**

492 સુનામુખી (મીંઢીઆવળ.)

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
493	વરશ.	512	છત્રી.
494	હુરડાં.	513	છત્રી જાપાનીશ.
495	છીપ.	514	છત્રી વાટરપ્રુફ.
496	હીંગડો (સીંગરૂપ).	515	માચીસ (કાંડી બાકસ).
497	પાખશાહામૃગના.	516	માચીસ લાલ વિલાયતી (સુલફર).
498	મુસ્તકા.	517	માચીસ કાલા વિલાયતી (સેફટી).
499	મુસ્તકા બશરાની.	518	માચીસ લાલ જાપાનીશ (સુલફર).
500	મુસ્તકા રૂપી (ઉંચી)	519	માચીસ કાળા જાપાનીશ (સેફટી).

501 ઇસ્કુસ.

502 ઇશશ બરાંજમનો.

503 ઇશશ મેથીઓ.

504 ઇશશનો જુડો.

505 લોબાન.

506 લોબાન કોડીઓ.

507 લોબાન રશનો.

508 લોબાન ટીનનો.

509 સાજીખાર.

510 મીણુ.

511 મીણબતી.

520 માચીસ રંગીન મેહેતાબી (લાલ પીલા).

521 આતસબાજી (બચ્ચાઓને ખેલવાની).

522 ફટાકડા (ચીનના) બચાઓને રમવાના.

523 ફટાકડા લવીંગીઆ.

524 ફટાકડા જાડા.

525 ફટાકડા વચરાશ.

526 નેતર.

527 નેતર ખુરશી ભરવાનુ.

528 નેતર ખુરશી ભરવાનું સફેત ઉંચો.

529 ચાય (ટી).

530 ચાય આખી.

531 ચાય ભુકી.

કોલમ (૨) બીજું ત્રણુ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
532	ચાય બંગાળી.	551	જનાવર.
533	ચાય સીલોન.	552	ઘોડા.
534	ચાય ચીનાઈ.	553	ઘોડા અરબી.
535	ચાય લીપટનના ડબા.	554	ઘોડા વેલર.
536	ચાય ગ્રીન (નીલી.)	555	ઘોડા રંગુની બટ.
537	કાફી (જુન.)	556	ઘોડા સોમાલી.
538	કાફી એબીસીન્યા (હરેરી).	557	ઘોડા હબસી.
539	કાફી મોખા (યમાની હોદેદા).		

540 કાફી સીંગાપુરી.

541 કાફી સીલોન.

542 કાફી કાળી.

543 કાફીના જફ્લ દાણાવાળા.

544 કાફીના જફ્લ પોલા.

545 કાફીનો કચરો.

546 નમુનો (સેમ્પલ.)

547 સ્ટેસનરી સામાન.

548 જુટ.

549 જુટ જુના સેકન્ડ હેન્ડ સોલઝરી.

550 સ્ટીફ્ર.

558 ઝઘેડા.

559 ખચ્ચર.

560 ઊંટ.

561 ચામડા.

562 ચામડાં ગાયનાં.

563 ચામડાં ગાયનાં રતલ ૫ થી ૮ વાળાં.

564 ચામડાં ગાયનાં રતલ ૯ થી ૧૨ વાળાં.

565 ચામડાં ગાયનાં રતલ ૧૨ થી ૧૫ વાળાં.

566 ચામડાં ગાયનાં રતલ ૧૫ થી ૧૮ વાળાં.

567 ગાયનાં ચામડાંનો કચરો.

568 ચામડાં બકરાનાં.

569 ચામડાં બકરાનાં મોટી રાશ.

કોલમ (૨) બીજું ત્રણુ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.
570	ચામડાં બકરાંનાં નાની રાશ.
571	ચામડાં ઘેટા (દુમ્બા) નાં.
572	ચામડાં ઘેટા (દુમ્બા) નાં મોટી રાસ.
573	ચામડાં ઘેટા (દુમ્બા) નાં નાની રાસ.
574	ચામડાં કાનપુરી.
575	ચામડાં વિલાયતી રંગીન.
576	કરીઆણું (ગંદીઆણું.)
577	સુંઠ.

નંબર.	માલનાં નામો.
589	સુંઠ જુની ચોચા (કરચલી).
590	સુંઠ કટકીની.
591	મરી કાળાં.
592	મરી કાળાં મલબારી ઉંચાં.
593	મરી કાળાં કોમઠાઇ.
594	મરી કાળાં પાલાઇ.
595	મરી કાળાં શીંગાપુરી ઉંચો નંબર ૧ લો.

578 સુંઠ કલીકોટી રાતી ઉંચી નંબર ૧ લો.

579 સુંઠ કલીકોટી રાતી વચરાસ ચલણી નંબર ૨.

580 સુંઠ કલીકોટી રંગેલી.

581 સુંઠ કલીકોટી વગર ધોયલી.

582 સુંઠ અલપી સફેત ધોયલી.

583 સુંઠ અલપી વગર ધોયલી.

584 સુંઠ મલબારી મુડાની (ગામઠી).

585 સુંઠ સફેત ચીનાઇ.

586 સુંઠ લોખંડી ચીનાઇ (હલકી).

587 સુંઠ બંગાળી.

588 સુંઠ જુની ડંકવાળી.

596 મરી કાળાં સીંગાપુરી વચરાશ નંબર ૧.

597 મરી કાળાં ઉંચાં.

598 મરી કાળાં હલકાં.

599 મરી કાળાં પોકલ.

600 મરી સફેત.

601 હલદર.

602 હલદર લદી.

603 હલદર મલબારી.

604 હલદર ચીનાઇ.

605 મરચાં લાલ (રાતાં).

606 મરચાં મછલીપટન.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪–૫–૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
607	મરચાં ગાટી ઝીણાં.	626	એલચીના ખોખા.
608	મરચાં હલકાં.	627	કેશર (જાફરાન).
609	જીરૂ.	628	કેશર ખોટી.
610	જીરૂં ગુજરાતનું.	629	જાયફળ.
611	જીરૂં સામી.	630	જાયફળના ત્રોફા.
612	જીરૂં હલકું.	631	ગુલાબનાં ફુલ.
613	ધાંણા.	632	ગુલાબનું પાણી.
614	અજમો.	633	માચાં કાળા.

615 વરીઆળી. (બડીસોફ).

616 તજ.

617 તજ નાની જુડી.

618 તજ મોટી જુડી.

619 લવીંગ.

620 લવીંગ ભેળસેળ (મેકસ).

621 લવીંગની દાંખરી.

622 લવીંગની દાંખરી જાડી.

623 એલચી.

624 એલચી મલબારી ઉંચી.

625 એલચી કાગદી ઉંચી.

634 પાંદરી.

635 પાંદરી વિલાયત બર.

636 પાંદરી વિલાયત બરે ગુણીઓમાં ભરેલ.

637 કુલીંજન.

638 કુલીંજન ઝીણી.

639 ખારો.

640 ખારો ગુલાબી.

641 આંબલી.

642 આંબલી બીજવાળી.

643 આંબલી બીજ વગરની.

644 શણ.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪–૫–૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
645	સુતલી.	664	ગુણી નવી ઇ. ૪૮/૨૮ લાલ પટો.
646	સુતલી કાચી.	665	ગુણી નવી ઇ. ૬૦/૩૦ રતલ ૫ ક્રોસસેક્ષ.
647	સુતલી પાકી.	666	ગુણી નવી ઇ. ૬૦/૩૦ રતલ ૬ા ક્રોસસેક્ષ.
648	સુતલી વિલાયતી.	667	ઓચર.
649	સીંદરી કાથાની.	668	બીલ ઑફ લેન્ડીંગ (સતમી).
650	કાથો ગાદલાં ભરવાનો.	669	ગેરન્ટી (જામીનગીરી).
651	કેતાન.	670	ગેરન્ટી (ખત. પતર. લખત).
652	કેતાન જાડો ઉંચો (ટાલ પતરી લાયક.)	671	હુંડી હવાલા ચેક વગેરે.

653 કેતાન વચરાસ ચલણી.
654 કેતાન હલકો.
655 બારદાન.
656 **ગુણી જુની** (સેકન્ડ હેન્ડ).
657 ગુણી નવી.
658 ગુણી નવી નં. ૧ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨॥ વાળી.
659 ગુણી નવી નં. ૧ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨॥= વાળી.
660 ગુણી નવી નં. ૧ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨॥ વાળી.
661 ગુણી નવી નં. ૨ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨॥ વાળી.
662 ગુણી નવી નં. ૨ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨। વાળી.
663 ગુણી નવી નં. ૨ ઇ. ૪૪/૨૬॥ રતલ ૨ વાળી.

672 ઉલન (ઊન).
673 રેશમ (હીર).
674 હીર પંજમ જાડો.
675 હીર ભરતનો ઝીણો.
676 પશમ.
677 રેશમી કાપડ.
678 રેશમ ગાટ ફુલાવર ચીનાઇ શેલ.
679 રેશમ ગાટ શાદો ચીનાઈ શેલ.
680 રેશમ ગાજ ફુલાવર ચીનાઇ.
681 રેશમ ગાજ શાદો ચીનાઇ.
682 રેશમ ગાજ ચીકન ભરત.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
683	રેશમ હોજરીઆ.	701	ગરમ ગાજ ફલાલીન.
684	રેશમ પાજ.	702	ગરમ કાશમીરી શાલ ઉંચી.
685	રેશમ સાટીન.	703	ગરમ કાશમીરી શાલ રૂમાલ ઉંચા.
686	રેશમ ચણાપાણી.	704	ગરમ વિલાયતી શાલ.
687	રેશમ ધોરેપટે.	705	ગરમ વિલાયતી શાલ રૂમાલ.
688	બનારસી.	706	ગરમ બ્લોનકીટ (બનુસ).
689	કીનખાબ.	707	ગરમ રેલવે રગ.
690	ચીક ભરત.		

691 ઝીક ભરત સુરતી.

692 કારચોપ ભરત.

693 બાદલો.

694 ગરમ કાપડ.

695 ગરમ બનાત.

696 ગરમ બનાત ડબલ પનાની.

697 ગરમ કુટીન.

698 ગરમ કાશમીર.

699 ગરમ આલપાકો.

700 ગરમ ફલાલીન.

708 કૉટન બનાત.

709 કૉટન ફલાલીન.

710 કૉટન ફ્લોનકીટ (ગુનસ).

711 કૉટન રેલવે રગ.

712 કપાસ (૩).

713 કપાસ ગુડ.

714 કપાસ ફુલીગુડ.

715 કપાસ ફાઇનગુડ.

716 કપ.સ કાચું ગુડ.

717 કાપડ સુતરૂ.

718 કાપડ ગામઠી લઠો.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો	નંબર.	માલનાં નામો.
719	જીન ખાખી ઉંચી સોલજરી.	738	મરીકાની ગામઠી રતલ ૮ મજગામ.
720	જીન ખાખી વચરાશ ચાલુ.	739	મરીકાની ગામઠી રતલ ૮ મોરારજી.
721	જીન ખાખી હંસ છાપ.	740	મરીકાની ગામઠી રતલ ૮ પીટીટ.
722	જીન સફેત હંશ છાપ.	741	કાપડ મરીકાની અસલી.
723	જીન સફેત મશીદ છાપ.	742	મરીકાની અસલી રતલ ૯। વાળી.
724	જીન ગામઠી.	743	મરીકાની અસલી રતલ ૮॥। વાળી.
725	જીન નંબર ૪૨૫.	744	મરીકાની અસલી રતલ ૮॥ વાળી.
726	જીન ધોયેલું હંશ છાપ.	745	મરીકાની અસલી રતલ ૮ વાળી.

727 કાટન ડક.

728 કાટન ડક હલકા.

729 ચેક.

730 ચેક ગામઠી.

731 ચેક ગામઠી મકદીશા બર.

732 ચેક વિલાયતી.

733 **કાપડ મરીકાની ગામઠી.**

734 મરીકાની ગામઠી રતલ ૯ વાળી.

735 મરીકાની ગામઠી રતલ ૮ વાળી

736 મરીકાની ગામઠી રતલ ૮ જીવરાજ.

737 મરીકાની ગામઠી રતલ ૮ સાસુન.

746 મરીકાની અસલી રતલ ૭॥ વાળી.

747 મરીકાની અસલી રતલ ૭ વાળી.

748 **કાપડ મરીકાની ઇટાલીઅના.**

749 મરીકાની ઇટાલીઅના રતલ ૮॥ વાળી.

750 મરીકાની ઇટાલીઅના રતલ ૮। વાળી.

751 મરીકાની ઇટાલીઅના રતલ ૭॥ વાળી.

752 મરીકાની ઇટાલીઅના રતલ ૭ વાળી.

753 મરીકાની ઇટાલીઅના રતલ ૬॥ વાળી.

754 મરીકાની ઇટાલીઅના રતલ ૬। વાળી.

755 **કાપડ મરીકાની માનચેસ્ટર.**

756 મરીકાની માનચેસ્ટર રતલ ૮। વાળી.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
757	મરીકાની માનચેસ્ટર રતલ ૭ાા વાળી.	775	લાંનકલૉથ ગામઠી.
758	મરીકાની માનચેસ્ટર રતલ ૭ા વાળી.	776	લાન કલૉથ ધોયલા (મામુંધી.)
759	મરીકાની માનચેસ્ટર રતલ ૭ વાળી.	777	લાન કલૉથ ધોયલો ૧૫૦૦ (મામુંધી.)
760	મરીકાની માનચેસ્ટર રતલ ૬ાા વાળી.	778	લાન કલૉથ ધોયલો ૪૦૦૦ (મામુંધી.)
761	મરીકાની માનચેસ્ટર રતલ ૬ વાળી.	779	લાન કલૉથ ધોયલા ૪૦૦૦૦ (મામુંધી.)
762.	કાપડ ગામઠી કોરૂં.	760	લાન કલૉથ ધોયલા ૧૮૮૦ (મામુંધી.)
763	કાપડ ગામઠી સાટીન.	781	લાન કલૉથ ધોયલા ૮૮૮૮ (મામુંધી.)

764 કાપડ ગામઠી શેટીન રતલ ૧૧ વાલ ૬૧.

765 કાપડ ગામઠી શેટીન રતલ ૯ા વાલ ૬૨.

766 કાપડ ગામઠી શેટીન રતલ ૧૫ા વાલ ૫૦.

767 કાપડ ગામઠી શેટીન રતલ ૮ વાલ ૩૬.

768 કાપડ ગામઠી શેટીન રતલ ૬ વાલ ૩૦.

769 કાપડ ગામઠી શેટીન રતલ ૨ાા ટાંડેલ ૮૦૦૦

770 માદરપાટ કોરા.

771 માદરપાટ કોરો રતલ ૧૦ ઉંચો.

772 માદરપાટ કોરો રતલ ૯.

773 માદરપાટ કોરો રતલ ૮.

774 માદરપાટ કોરો રતલ ૭.

782 લાન કલૉથ ધોયલા ચાર એકસ. (મામુંધી.)

783 લાન કલૉથ ધોયલો ખળીઓ. (મામુંધી.)

784 લાન કલૉથ ધોયલો જાડો ખળીઓ. (મામુંધી.)

785 લાન કલૉથ ધોયલો નરમ કુમાશ ખળીઓ. (મામુંધી.)

786 **ધોતીયાં વિલાયતી.**

787 ધોતીયાં ગામઠી.

788 ધોતીયાં અમદાવાદી $\frac{૩૭૦૦}{૭}$

789 ધોતીયાં અમદાવાદી $\frac{૩૭૦૦}{૮}$

790 ધોતીયાં અમદાવાદી $\frac{૪૧૪૧}{૭}$

791 ધોતીયાં અમદાવાદી $\frac{૪૧૪૧}{૮}$

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
792	આડીઆ.	811	જગન્નાથી કોરી.
793	આડીઆ વિલાયતી.	812	નેનસુક ધોયલા.
794	આડીઆ ગામઠી.	813	દોરીઆ.
795	ચાદર.	814	જામદાની.
796	ચાદર ૧૦૨૫	815	ચીકન.
797	ચાદર ૬૨૫.	816	નેટ.
798	ચાદર ફેનશી.	817	નેટ ફુલ્લાવર.
799	ચાદર ગામઠી.	818	નેટ મોટે પને.

800 ચાદર ગામઠી ૧૦૦૧

801 મલમલ ધોયલી.

802 મલમલ ધોયલી ૫૫.

803 મલમલ ધોયલી આહામ ૧૦૦.

804 મલમલ ધોયલી ૫૦૬૦.

805 મલમલ ધોયલી ૯૭૫.

806 મલમલ બંગાળી ધોયલી.

807 મલમલ ડબાની ધોયલી.

808 મલમલ ધોયલી જાનપીલ.

809 મલમલ કોરી.

810 જગન્નાથી ધોયલી.

819 નેટ ટુંકે પને.

820 નેટ રંગેલી કાળી.

821 ગાજ.

822 ગાજ મોટે પને.

823 ગાજ રંગીન વાર ૧૨ વાળા.

824 થોબ.

825 થોબ પ્રેસીડેન્સી

826 મજલીન.

827 બુક મજલીન.

828 છીટ મજલીન.

829 કસુંબો (મધરો).

830 કસુંબો પાકા રંગનો.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
831	કસુંબો કાચા રંગનો.	849	કટપીશ સાડીઓ પાતલના કટકા
832	કસુંબો જુન.	850	કટપીશ ધોયલો (ટુકડા.) „
833	પાતલ.	851	કટપીશ સફેત ધોમ્માસ.
834	સાડીઓ.	852	કટપીશ રંગીન ધોમ્માસ.
835	ચુંદડી.	853	કટપીશ ગરમ ઝીણો માલ.
836	ઓઢણી.	854	કટપીશ ગરમ જાડો માલ.
837	દુમ્માસ.	855	સુતર.
		856	સુતર સફેત ગામઠી.

838 કુમ્માસ રંગીન.

839 ખાંગા.

840 ખાંગા જંગબારી.

841 ખાંગા મલબારી.

842 ટોવાલ ગામઠી.

843 ટોવાલ તુરકી.

844 છીટ.

845 કટપીશ (ટુકડા.)

846 કટપીશ કોર ,,

847 કટપીશ છીટ. ,,

848 કટપીશ છીટ મજલીન ઝીણી (ટુકડા.)

857 સુતર સફેત ગામઠી ના. ૬॥

858 સુતર સફેત ગામઠી ના. ૬॥ લીવરપુલ

859 સુતર સફેત ગામઠી ના. ૬॥ કરીમભાઈ.

860 સુતર સફેત ગામઠી ના. ૬॥ ચાયના.

861 સુતર સફેત ગામઠી ના. ૬॥ ડેવીડ.

862 સુતર સફેત ગામઠી ના. ૬॥ સાસુન.

863 સુતર સફેત ગામઠી ના. ૬॥ શોરાબ.

864 સુતર સફેત ગામઠી ના. ૬॥ સ્ટાનડર.

865 સુતર સફેત ગામઠી ના. ૬॥ પાલખી.

866 સુતર સફેત ગામઠી ના. ૧૦.

867 સુતર સફેત ગામઠી ના. ૧૦ કુલાબા અડધો ચાંદ.

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪-૫-૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
868	સુતર સફેત ગામઠી ના. ૧૦ રીપન.	886	સુતર સફેત ગામઠી ના. ૨૦ કયસરહીન્દ.
869	સુતર સફેત ગામઠી ના. ૧૦ મંગલદાસ.	887	સુતર સફેત ગામઠી ના. ૨૦ ઇશલામ કારો દોરો.
870	સુતર સફેત ગામઠી ના. ૧૦ એડવર્ડ.	888	સુતર સફેત ગામઠી ના. ૩૦
871	સુતર સફેત ગામઠી ના. ૧૦ માણેકજી.	889	સુતર સફેત ગામઠી ના. ૩૦ વીરમગામ.
872	સુતર સફેત ગામઠી ના. ૧૦ સુરજ[illegible]સ્વતી.	890	સુતર સફેત ગામઠી ના ૩૦ ભરૂચ.
873	સુતર સફેત ગામઠી ના. ૧૦ શોરાબ.	891	સુતર સફેત ગામઠી ના ૩૦ લલુ રાયજી.
874	સુતર સફેત ગામઠી ના. ૧૦ જમશેદ.	892	સુતર કસુંબી ગામઠી ના. ૨૦
		893	સુતર કસુંબી ના. ૨૦ ગામઠી સાત સુરજ.

875 સુતર સફેત ગામઠી ના. ૧૦ ઇશલામ.

876 સુતર સફેત ગામઠી ના. ૧૦ કયશરહીન્દ.

877 સુતર સફેત ગામઠી ના. ૧૦ વીઠલ ગોપાળ.

878 **સુતર સફેત ગામઠી ના. ૨૦**

879 સુતર સફેત ગામઠી ના. ૨૦ વિક્ટોરીઆ.

880 સુતર સફેત ગામઠી ના. ૨૦ નવું વિક્ટોરીઆ.

881 સુતર સફેત ગામઠી ના. ૨૦ ગુલાબ બાબા.

882 સુતર સફેત ગામઠી ના. ૨૦ નડીઆદ.

883 સુતર સફેત ગામઠી ના. ૨૦ માણકજી.

884 સુતર સફેત ગામઠી ના. ૨૦ શોરાબ.

885 સુતર સફેત ગામઠી ના. ૨૦ કુલાબા.

894 સુતર કસુંબી ના. ૨૦ ગામઠી બે છોકરા.

895 **સુતર રંગીન ગામઠી ના. ૨૦ ઘોડા છાપ.**

896 સુતર રંગીન ના. ૨૦ ગામઠી ઘોડા છાપ લીમ્બુડી.

897 સુતર લીલુ ગેરૂ ના. ૨૦ ગામઠી ઘોડા છાપ.

898 સુતર ના. ૨૦ ગામઠી ઘોડા છાપ પીળુ સોનેરી.

899 સુતર ના. ૨૦ ગામઠી ઘોડા છાપ કેશરીઉ.

900 સુતર ના. ૨૦ ગામઠી ઘોડા છાપ અડધું ગેરૂં.

901 **સુતર ના. ૨૦ રંગીન ગામઠી ગધા છાપ.**

902 સુતર ના. ૨૦ ગામઠી ગધા છાપ લીલું ગેરૂં.

903 સુતર ના. ૨૦ ગામઠી ગધા છાપ પીળુ સોનેરી.

904 સુતર ના. ૨૦ ગામઠી ગધા છાપ કેશરીઉ.

કોલમ (૨) બીજું ત્રણુ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠ્ઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
905	સુતર ના. ૨૦ ગામઠી ગધ્ધા છાપ લીમ્બુડી.	923	સુતર સફેત ના. ૩૦ વિલાયતી વાટર હાથીછાપ.
906	સુતર કસુંબી ના. ૩૦ ગામઠી બે છે.કરા.	924	સુતર સફેત ના ૩૦ વિલાયતી વટર રાણી છાપ.
907	સુતર કસુંબી ના. ૪૦ ગામઠી બે છોકરા.	925	સુતર સફેત ના. ૩૦ વિલાયતી વાટર જુટા છાપ.
908	સુતર કસુંબી ના. ૩૦ વિલાયતી.	926	સુતર સફેત ના. ૩૦ વિલાયતી વાટર વાવટા છાપ.
909	સુતર કસુંબી ના. ૩૦ વિલાયતી મોર છાપ.	927	સુતર સફેત ના. ૪૦ વિલાયતી વાટર.
910	સુતર કસુંબી ના. ૩૦ વિલાયતી ઘોડા છાપ.	928	સુતર સફેત ના. ૪૦ વિલાયતી વાટર હાથી છાપ.
911	સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહ્રામ.	929	સુતર સફેત ના. ૪૦ વિલાયતી વાટર રાણી છાપ.

912 સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહામ એ હાથી
913 સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહામ એ સસલા
914 સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહામ પોપટ.
915 સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહામ ઘોડેસ્વાર
916 સુતર કસુંબી ના. ૪૦ વિલાયતી આહામ મોર છાપ
917 **સુતર સફેત ના. ૩૦ વિલાયતી ડબલ ધોયલું.**
918 **સુતર સફેત ના. ૪૦ વિલાયતી સીંગલ ધોયલું.**
919 સુતર સફેત ના. ૪૦ વિલાયતી ડબલ કોરૂં.
920 **સુતર સફેત ના ૮૦ વિલાયતી ડબલ કોરૂં.**
921 સુતર સફેત ના. ૮૦ વિલાયતી ડબલ ધોયલું.
922 **સુતર સફેત ના. ૬૦ વિલાયતી વાટર.**

930 સુતર સફેત ના. ૪૦ વિલાયતી વાટર વાવટા છાપ.
931 સુતર સફેત ના. ૪૦ વિલાયતી વાટર ખેતી છાપ.
932
933
934
935
936
937
938
939
940

કોલમ (૨) બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠ્ઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
941		958	
942		959	
943		960	
944		961	
945		962	
946		963	
947		964	

948
949
950
951
952
953
954
955
956
957

965
966
967
968
969
970
971
972
973

કોલમ (૨)બીજું ત્રણ અંકી નંબરોનું ૪—૫—૬

માલના નામો માટેનો ચોથો પાંચમો અને છઠો અંક.

નંબર.	માલનાં નામો.	નંબર.	માલનાં નામો.
974		991	
975		992	
976		993	
977		994	
978		995	
979		996	
980		997	

981
82
983
984
985
986
987
988
989
990

998
999
000

સુરમો.

કચ્છ રાજયના અત્તાર ઉમરજાનમોહમદના હાથે બનાવેલો ખાસ સુરમો.

આ સુરમો આંખમાં આંઝવાથી આંખના દરદો જેવાંકે ફુલો, મોતીઓ, નઝલો, ઝાંખ વગેરે મટાડી આંખને સ્વચ્છ કરે છે, અને થતા રોગનો અટકાવ કરે છે. જ્યારે આંખ આવવાનો ભય રહેતો નથી.

કિમત તોલા ૧ ની શીશીના રૂ. ૨—૦—૦

તોલા અડધાની શીશીનો રૂ. ૧—૪—૦

લખો :—

આ બુકના કર્તા

હાજી સુલેમાન ઈસ્માઈલ અંજારવાલાને

અથવા

ઊમર જાનમોહમદ અત્તરવાલાને

કચ્છ—ભુજ.

કોલમ (૩)ત્રીજું બે અંકી નંબરોનું ૭-૮

કીમત (ભાવ) માટેનો સાતમો અને આઠમો અંક.

નંબર	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)
01	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦	ભાવ ૦ ૦ ૦
02	,, ૦)-	,, ૨)૦॥	,, ૧૦॥	,, ૨૮।	,, ૭૧)=	,, ૧૬૩॥।	,, ૩૮૦
03	,, ૦)-।	,, ૨)-	,, ૧૦॥=	,, ૨૮॥	,, ૭૧॥	,, ૧૬૫	,, ૩૭૨॥
04	,, ૦)-॥	,, ૨)-॥	,, ૧ ।॥	,, ૨૮॥।	,, ૭૨)=	,, ૧૬૬।	,, ૩૮૫
05	,, ૦)-।।	,, ૨)=	,, ૧૦॥=	,, ૨૯)-	,, ૭૨॥	,, ૧૬૭॥	,, ૩૯૦
06	,, ૦)=	,, ૨)=॥	,, ૧૧)-	,, ૨૯।	,, ૭૩)=	,, ૧૬૮॥।	,, ૩૯૫
07	,, ૦)=।	,, ૨)≡	,, ૧૧)=	,, ૨૯॥	,, ૭૩॥	,, ૧૭૦	,, ૩૭૭।
08	,, ૦)=॥	,, ૨)≡॥	,, ૧૧।	,, ૨૯॥।	,, ૭૪)=	,, ૧૭૧	,, ૪૦૦
09	,, ૦)=॥।	,, ૨।	,, ૧૧।=	,, ૩૦	,, ૭૪॥	,, ૧૭૨॥	,, ૩૮૨॥

10	,, ૦)≡	,, ૨। ૦॥	,, ૧૧॥	,, ૩૦।	,, ૭૫	,, ૧૭૩॥	,, ૩૯૭॥
11	,, ૦)≡	,, ૨।-	,, ૧૧॥=	,, ૩૦॥	,, ૭૫॥	,, ૧૬૫	,, ૩૯૨॥
12	,, ૦)≡॥	,, ૨।-॥	,, ૧૧॥।	,, ૩૦॥।	,, ૭૬।	,, ૧૭૬।	,, ૪૦૫
13	,, ૦)≡॥।	,, ૨।=	,, ૧૧॥।=	,, ૩૧)-	,, ૭૬॥।	,, ૧૭૭॥	,, ૪૧૦
14	,, ૦।	,, ૨।=॥	,, ૧૨)-	,, ૩૧।	,, ૭૭॥	,, ૧૭૮॥।	,, ૪૧૫
15	,, ૦। ૦।	,, ૨।≡	,, ૧૨)=	,, ૩૧॥	,, ૭૮।	,, ૧૮૦	,, ૩૯૭॥
16	,, ૦। ૦॥	,, ૨।≡॥	,, ૧૨।	,, ૩૧॥।	,, ૭૮।।	,, ૧૮૧।	,, ૪૨૦
17	,, ૦। ૦॥।	,, ૨॥	,, ૧૨।=	,, ૩૨)-	,, ૭૯।	,, ૧૮૨॥	,, ૪૨૫
18	,, ૦।-	,, ૨॥-	,, ૧૨॥	,, ૩૨।	,, ૮૦	,, ૧૮૩॥।	,, ૪૦૨॥
19	,, ૦।-।	,, ૨॥=	,, ૧૨॥=	,, ૩૨॥	,, ૮૦॥	, ૧૮૫	,, ૪૦૭॥
20	,, ૦।-॥	,, ૨॥≡	,, ૧૨॥।	,, ૩૨॥।	,, ૮૧।	,, ૧૮૬।	,, ૪૩૦

કૅાલમ (૩)ત્રીજું બે અંકી નંબરોનું ૭–૮

કીમત (ભાવ) માટેનો સાતમો અને આઠમો અંક.

નંબર	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)
21	ભાવ ૦।~।।।	ભાવ ૨।।।	ભાવ ૧૨।।।=	ભાવ ૩૩)~	ભાવ ૮૧।।।	ભાવ ૧૮૭।।	ભાવ ૪૩૫
22	,, ૦।=	,, ૨।।।~	,, ૧૩)~	,, ૩૩।	,, ૮૨।।	,, ૧૮૮।।।	,, ૪૪૦
23	,, ૦।=।	,, ૨।।।=	,, ૧૩)=	,, ૩૩।।	,, ૮૩।	,, ૧૯૦	,, ૪૧૨।।
24	,, ૦।=।।	,, ૨।।।≡	,, ૧૩।	,, ૩૩।।।	,, ૮૩।।।	,, ૧૯૧।	,, ૪૪૫
25	,, ૦।=।।।	,, ૨।।।≡।।	,, ૧૩।=	,, ૩૪)~	,, ૮૪।	,, ૧૯૨।।	,, ૪૫૦
26	,, ૦।≡	,, ૩)૦।।	,, ૧૩।।	,, ૩૪।	,, ૮૫	,, ૧૯૩।।।	,, ૪૧૭।।
27	,, ૦।≡।	,, ૩)~	,, ૧૩।।=	,, ૩૪।।	,, ૮૫।।	,, ૧૯૫	,, ૪૨૨।।
28	,, ૦।≡।।	,, ૩)=	,, ૧૩।।।	,, ૩૪।।।	,, ૮૬।	,, ૧૯૬।	,, ૪૫૫
29	,, ૦।≡।।।	,, ૩)≡	,, ૧૩।।।=	,, ૩૫	,, ૮૬।।।	,, ૧૯૭।।	,, ૪૨૭।।

30	,,	૦॥	,,	૩।	,,	૧૪)-	,,	૩૫॥	,,	૮૭॥	,,	૧૯૮॥।	,,	૪૬૦
31	,,	૦॥ ૦।	,,	૩।-	,,	૧૪)=	,,	૩૬)=	,,	૮૮।	,,	૨૦૦	,,	૪૩૨॥
32	,,	૦॥ ૦॥	,,	૩।=	,,	૧૪।	,,	૩૬॥	,,	૮૮॥	,,	૨૦૨॥	,,	૪૬૫
33	,,	૦॥ ૦॥।	,,	૩।≡	,,	૧૪।=	,,	૩૭)=	,,	૮૯।	,,	૨૦૫	,,	૪૩૭॥
34	,,	૦॥-	,,	૩॥	,,	૧૪॥	,,	૩૭॥	,,	૯૦	,,	૨૦૭॥	,,	૪૪૨॥
35	,,	૦॥-।	,,	૩॥-	,,	૧૪॥=	,,	૩૮)=	,,	૯૦॥	,,	૨૧૦	,,	૪૪૭॥
36	,,	૦॥-॥	,,	૩॥=	,,	૧૪॥।	,,	૩૮॥	,,	૯૧।	,,	૨૧૨॥	,,	૪૭૦
37	,,	૦॥-॥।	,,	૩॥≡	,,	૧૪॥।=	,,	૩૯)=	,,	૯૧॥।	,,	૨૧૫	,,	૪૫૨॥
38	,,	૦॥=	,,	૩॥।	,,	૧૫	,,	૩૯॥	,,	૯૨॥	,,	૨૧૭॥	,,	૪૫૭॥
39	,,	૦।=।	,,	૩॥।-	,,	૧૫)=	,,	૪૦	,,	૯૩।	,,	૨૨૨॥	,,	૪૬૨॥
40	,,	૦॥=॥	,,	૩॥।=	,,	૧૫।	,,	૪૦॥	,,	૯૩॥।	,,	૨૨૦	,,	૪૬૭॥

કોલમ (૩)ત્રીજું બે અંકી નંબરોનું ૭-૮

કીમત (ભાવ) માટેનો સાતમો અને આઠમો અંક.

નંબર	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)
41	ભાવ ૦ાાન્નાા	ભાવ ૩ાાન્ન	ભાવ ૧૫ા=	ભાવ ૪૧)=	ભાવ ૯૪ા	ભાવ ૨૨૫	ભાવ ૪૭૨ાા
42	,, ૦ાાન્ન	,, ૪)૦ાા	,, ૧૫ાા	,, ૪૧ાા	,, ૯૫	,, ૨૨૭ાા	,, ૪૭૭ાા
43	,, ૦ાાન્ના	,, ૪)-	,, ૧૫ાા=	,, ૪૨)=	,, ૯૫ાા	,, ૨૩૦	,, ૪૮૨ાા
44	,, ૦ાાન્ના	,, ૪)=	,, ૧૫ાાા	,, ૪૨ાા	,, ૯૬ા	,, ૨૩૨ાા	,, ૪૭૫
45	,, ૦ાાન્નાાા	,, ૪ન્ન	,, ૧૫ાાા=	,, ૪૩)=	,, ૯૬ાાા	,, ૨૩૫	,, ૪૮૭ાા
46	,, ૦ાાા	,, ૪ા	,, ૧૬)-	,, ૪૩ાા	,, ૯૭ાા	,, ૨૩૭ાા	,, ૪૯૦
47	,, ૦ાાા૦	,, ૪ા-	,, ૧૬)=	,, ૪૪)=	,, ૯૮ા	,, ૨૪૦	,, ૪૯૨ાા
48	,, ૦ાાા૦ાા	,, ૪ા=	,, ૧૬ા	,, ૪૪ાા	,, ૯૮ાાા	,, ૨૪૫	,, ૪૯૭ાા
49	,, ૦ાાા૦ાાા	,, ૪ાન્ન	,, ૧૬ા=	,, ૪૫	,, ૯૯ા	,, ૨૪૨ાા	,, ૫૦૦ાા

50	,, ૦॥।–	,, ૪॥	,, ૧૬॥	,, ૪૫॥	,, ૧૦૦	,, ૨૪૭॥	,, ૫૦૨॥
51	,, ૦॥।–।	,, ૪॥–	,, ૧૬॥=	,, ૪૬)=	,, ૧૦૧।	,, ૨૫૦	,, ૫૦૫
52	,, ૦॥।–॥	,, ૪॥=	,, ૧૬॥।	,, ૪૬॥	,, ૧૦૨॥	,, ૨૫૨॥	,, ૪૮(૫)
53	,, ૦॥।–॥।	,, ૪॥≡	,, ૧૬॥।=	,, ૪૭)=	,, ૧૦૩॥।	,, ૨૫૫	,, ૫૦૯॥
54	,, ૦॥।=	,, ૪॥	,, ૧૭)–	,, ૪૭॥	,, ૧૦૫	,, ૨૫૭॥	,, ૫૧૦।
55	,, ૦॥।=।	,, ૪॥।–	,, ૧૭)=	,, ૪૮)=	,, ૧૦૬।	,, ૨૬૦	,, ૫૧૨॥
56	,, ૦॥।=॥	,, ૪॥।=	,, ૧૭।	,, ૪૮॥	,, ૧૦૭॥	,, ૨૬૫	,, ૫૧૫।
57	,, ૦॥।=॥।	,, ૫	,, ૧૭।=	,, ૪૯)=	,, ૧૦૮॥।	,, ૨૬૨॥	,, ૫૧૭॥
58	,, ૦॥।≡	,, ૫)=	,, ૧૭॥	,, ૪૯॥	,, ૧૧૦	,, ૨૬૭॥	,, ૫૨૦।
59	,, ૦॥।≡।	,, ૫।	,, ૧૭॥।	,, ૫૦	,, ૧૧૧।	,, ૨૭૨॥	,, ૫૨૨॥
60	,, ૦॥।≡॥	,, ૫।=	,, ૧૮)–	,, ૫૦॥	,, ૧૧૨॥	,, ૨૭૦	,, ૫૨૫।

કોલમ (૩)ત્રીજું બે અંકી નંબરોનું ૭-૮

કીમત (ભાવ) માટેનો સાતમો અને આઠમો અંક.

નંબર	કીમત (ભાવ)		કીમત (ભાવ)		કીમત (ભાવ)		કીમત (ભાવ)		કીમત (ભાવ)		કીમત (ભાવ)		કીમત (ભાવ)	
61	ભાવ	૦॥≡॥	ભાવ	૫॥	ભાવ	૧૮।	ભાવ	૫૧)=	ભાવ	૧૧૩॥।	ભાવ	૨૭૫	ભાવ	૫૨૦॥
62	„	૧)૦।	„	૫॥=	„	૧૮॥	„	૫૧॥	„	૧૧૫	„	૨૭૭॥	„	૫૩૦।
63	„	૧)૦॥	„	૫॥।	„	૧૮॥।	„	૫૨)=	„	૧૧૬।	„	૨૮૦	„	૫૩૨॥
64	„	૧)૦॥।	„	૫॥।=	„	૧૯)-	„	૫૨॥	„	૧૧૭॥	„	૨૮૫	„	૫૩૫॥
65	„	૧)-	„	૬)૦॥	„	૧૯।	„	૫૩)=	„	૧૧૮॥।	„	૨૯૦	„	૫૩૭॥
66	„	૧)-।	„	૬)=	„	૧૯॥	„	૫૩॥	„	૧૨૦	„	૨૮૨॥	„	૫૪૦।
67	„	૧)-॥	„	૬।	„	૧૯॥।	„	૫૪)=	„	૧૨૧।	„	૨૯૫	„	૫૪૨॥
68	„	૧)-॥।	„	૬।=	„	૨૦	„	૫૪॥	„	૧૨૨॥	„	૨૯૭॥	„	૫૪૫॥
69	„	૧)-	„	૬॥	„	૨૦।	„	૫૫	„	૧૨૩॥।	„	૨૯૨॥	„	૫૪૭॥

70	,,	૧)≡	,,	૬॥=	,,	૨૦॥	,,	૫૫॥	,,	૧૨૫	,,	૨૯૭॥	,,	૫૫૦।
71	,,	૧)=॥	,,	૬॥।	,,	૨૦॥।	,,	૫૬)=	,,	૧૨૬।	,,	૩૦૦	,,	૫૫૨॥
72	,,	૧)=॥।	,,	૬॥।=	,,	૨૧)-	,,	૫૬॥	,,	૧૨૭॥	,,	૩૦૫	,,	૫૫૫।
73	,,	૧)≡	,,	૭)૦॥	,,	૨૧।	,,	૫૭)=	,,	૧૨૮॥।	,,	૩૧૦	,,	૫૫૭॥
74	,,	૧)≡	,,	૭)=	,,	૨૧॥	,,	૫૭॥	,,	૧૩૦	,,	૩૦૨॥	,,	૫૬૦।
75	,,	૧)≡॥	,,	૭।	,,	૨૧॥।	,,	૫૮)=	,,	૧૩૧।	,,	૩૧૫	,,	૫૬૨॥
76	,,	૧)≡॥।	,,	૭)=	,,	૨૨)-	,,	૫૮॥	,,	૧૩૨॥	,,	૩૨૦	,,	૫૬૫।
77	,,	૧।	,,	૭॥	,,	૨૨।	,,	૫૯)=	,,	૧૩૩॥।	,,	૬૨૫	,,	૫૬૭॥
78	,,	૧। ૦॥	,,	૭॥=	,,	૨૨॥	,,	૫૯॥	,,	૧૩૫	,,	૩૦૭॥	,,	૫૭૦।
79	,,	૧।-	,,	૭॥	,,	૨૨॥।	,,	૬૦	,,	૧૩૬।	,,	૩૧૨॥	,,	૫૭૨॥
80	,,	૧।-॥	,,	૭॥।=	,,	૨૩)-	,,	૬૦॥	,,	૧૩૭॥	,,	૩૧૭॥	,,	૪૯૭

કોલમ (૩)ત્રીજું એ અંકી નંબરોનું ૭-૮

કીમત (ભાવ) માટેનો સાતમો અને આઠમો અંક.

નંબર	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)	કીમત (ભાવ)
81	ભાવ ૧ા=	ભાવ ૮)૦ાા	ભાવ ૨઼ા	ભાવ ૬૧)=	ભાવ ૧૩૮ાા	ભાવ ૩૨૨ાા	ભાવ ૪૯૫
82	„ ૧ા=ાા	„ ૮)=	„ ૨૩ાા	„ ૬૧ાા	„ ૧૪૦	„ ૩૨૭ાા	„ ૫૭૫ા
83	„ ૧ા≡	„ ૮ા	„ ૨૩ાાા	„ ૬૨)=	„ ૧૪૧ા	„ ૩૩૦	„ ૫૭૭ાા
84	„ ૧ા≡ા	„ ૮ા=	„ ૨૪)૦	„ ૬૨ાા	„ ૧૪૨ાા	„ ૩૩૫	„ ૫૮૦ા
85	„ ૧ાા	„ ૮ાા	„ ૨૪ા	„ ૬૩)=	„ ૧૪૩ાાા	„ ૩૪૦	„ ૫૮૨ાા
86	„ ૧ાા ૦ાા	„ ૮ાા=	„ ૨૪ાા	„ ૬૩ાા	„ ૧૪૫	„ ૩૩૨ાા	„ ૫૮૫ાા
87	„ ૧ાા૦	„ ૮ાાા	„ ૨૪ાાા	„ ૬૪)=	„ ૧૪૬ા	„ ૩૪૫	„ ૫૮૭ાા
88	„ ૧ાા–ાા	„ ૮ાાા=	„ ૨૫	„ ૬૪ાા	„ ૧[illegible]ાા	„ ૩૩૭ાા	„ ૫૯૦ા
89	„ ૧ાા≡	„ ૯)૦ાા	„ ૨૫ા	„ ૬૫	„ ૧૪૮ાાા	„ ૩૪૨ાા	„ ૫૯૨ાા

90	„	૧॥=॥	„	૯)=	„	૨૫॥	„	૬૫॥	„	૧૫૦	„	૩૪૭॥	„	૫૯૫।
91	„	૧॥≡	„	૯।	„	૨૫॥।	„	૬૬)=	„	૧૫૧।	„	૩૫૦	„	૫૯૭॥
92	„	૧॥≡॥	„	૯।=	„	૨૬)–	„	૬૬॥	„	૧૫૨॥	„	૩૫૫	„	૬૦૦॥
93	„	૧॥।	„	૯॥	„	૨૬।	„	૬૭)=	„	૧૫૩॥।	„	૩૬૦	„	૬૦૨॥
94	„	૧॥। ૮॥	„	૯॥=	„	૨૬॥	„	૬૭॥	„	૧૫૫	„	૩૫૨॥	„	૬૦૫।
95	„	૧॥।–	„	૯॥।	„	૨૬॥।	„	૬૮)=	„	૧૫૬।	„	૩૬૫	„	૬૦૭॥
96	„	૧॥।–॥	„	૯॥।=	„	૨૭)–	„	૬૮॥	„	૧૫૭॥	„	૩૯૦	„	૬૧૦।
97	„	૧॥।=	„	૧૦	„	૨૭	„	૬૯)=	„	૧૫૮।।	„	૩૫૭॥	„	૬૧૨॥
98	„	૧॥।=॥	„	૧૦)=	„	૨૭॥	„	૬૯॥	„	૧૬૦	„	૩૬૨॥	„	૬૧૫।
99	„	૧॥।≡	„	૧૦।	„	૨૭॥।	„	૭૦	„	૧૬૧।	„	૩૬૭॥	„	૬૧૭॥
00	„	૧॥।≡॥	„	૧૦।=	„	૨૮)–	„	૭૦॥	„	૧૬૨॥	„	૩૭૫	„	૬૨૦।

જાહેર ખબર.

સર્વ સદ્ગૃહસ્થ વ્યાપારીઓને ખબર આપવામાં આવે છે કે આએ ગુજરાતી ટેલીગ્રાફીક કોડ બુકનો અંગ્રેજી તરજુમો તરતજ બહાર પડશે માટે જે સાહેબો અગાઊથી ગ્રાહક થઈ નામ નોંધાવશે તેઓ પાસેથી નકલ દીઠ કિંમત રૂ ૨-૮ [અર્ધી] લેવામાં આવશે

છપાઇ બહાર પડયા પછી તેની કિંમત રૂપીઆ ત્રણ રાખવામાં આવશે માટે તાકીદે લખોઃ—

આ બુકના કર્તા,

હાજી સુલેમાન ઇસ્માઇલ અંજારવાળાને;

ઠે. ઊમર જાનમોહોમદ અત્તરવાળાને ત્યાં

કચ્છ—ભુજ

[૪] કોલમ ૪ ચોથું બેઅંકી નંબરોનું ૯—૧૦

દાગીનાની સંખ્યા માટેનો નવમો અને દશમો અંક

નંબર દાગીનાની સંખ્યા	નંબર દાગીનાની સંખ્યા.	નંબર દાગીનાની સંખ્યા.	નંબર દાગીનાની સંખ્યા.	નંબર દાગીનાની સંખ્યા.
01 સંખ્યા ૦	21 સંખ્યા ૭૫	41 સંખ્યા ૮૫૦	61 સંખ્યા ૪૦૦૦	81 સંખ્યા ૧૬૦૦૦
02 ,, ૧	22 ,, ૮૫	42 ,, ૯૦૦	62 ,, ૪૨૫૦	82 ,, ૧૭૦૦૦
03 ,, ૨	23 ,, ૧૦૦	43 ,, ૧૦૦૦	63 ,, ૪૫૦૦	83 ,, ૧૮૦૦૦
04 ,, ૩	24 ,, ૧૨૫	44 ,, ૧૧૦૦	64 ,, ૪૭૫૦	84 ,, ૧૯૦૦૦
05 ,, ૪	25 ,, ૧૫૦	45 ,, ૧૨૦૦	65 ,, ૫:૦૦	85 ,, ૨૦૦૦૦
06 ,, ૫	26 ,, ૧૭૫	46 ,, ૧૩૦૦	66 ,, ૫૫૦૦	86 ,, ૨૨૫ ૦
07 ,, ૬	27 ,, ૨૦૦	47 ,, ૧૪૦૦	67 ,, ૬૦૦૦	87 ,, ૨૫૦૦૦
08 ,, ૮	28 ,, ૨૨૫	48 ,, ૧૫૦૦	68 ,, ૬૫૦૦	88 ,, ૨૭૫૦૦
09 ,, ૧૦	29 ,, ૨૫૦	49 ,, ૧૬૦૦	69 ,, ૭૦૦૦	89 ,, ૩૦૦૦૦

10	,,	૧૨	30	,,	૩૦૦	50	,,	૧૭૦૦	70	,,	૭૫૦૦	90	,,	૩૨૫૦૦
11	,,	૧૫	31	,,	૩૫૦	51	,,	૧૮૦૦	71	,,	૮૦૦૦	91	,,	૩૫૦૦૦
12	,,	૧૭	32	,,	૪૦૦	52	,,	૧૯૦૦	72	,,	૮૫૦૦	92	,,	૩૭૫૦૦
13	,,	૨૦	33	,,	૪૫૦	53	,,	૨૦૦૦	73	,,	૯૦૦૦	93	,,	૪૦૦૦૦
14	,,	૨૫	34	,,	૫૦૦	54	,,	૨૨૫૦	74	,,	૯૫૦૦	94	,,	૪૫૦૦૦
15	,,	૩૦	35	,,	૫૫૦	55	,,	૨૫૦૦	75	,,	૧૦૦૦૦	95	,,	૫૦૦૦૦
16	,,	૩૫	36	,,	૬૦૦	56	,,	૨૭૫૦	76	,,	૧૧૦૦૦	96	,,	૫૫૦૦૦
17	,,	૪૦	37	,,	૬૫૦	57	,,	૩૦૦૦	77	,,	૧૨૦૦૦	97	,,	૬૦૦૦૦
18	,,	૪૫	38	,,	૭૦૦	58	,,	૩૨૫૦	78	,,	૧૩૦૦૦	98	,,	૬૫૦૦૦
19	,,	૫૦	39	,,	૭૫૦	59	,,	૩૫૦૦	79	,,	૧૪૦૦૦	99	,,	૭૦૦૦૦
20	,,	૬૦	40	,,	૮૦૦	60	,,	૩૭૫૦	80	,,	૧૫૦૦૦	00	,,	૭૫૦૦૦

બે બે અંક એ લખવા માટેના જોડાક્ષરો. ના૦ ૧ લો.

01	Ba.	21	Be.	41	Bi.	61	Bo.	81	Bu.
02	Ca.	22	Ce.	42	Ci.	62	Co.	82	Cu.
03	Da.	23	De.	43	Di.	63	Do.	83	Du.
04	Fa.	24	Fe.	44	Fi.	64	Fo.	84	Fu.
05	Ga.	25	Ge.	45	Gi.	65	Go.	85	Gu.
06	Ha.	26	He.	46	Hi.	66	Ho.	86	Hu.
07	Ja.	27	Je.	47	Ji.	67	Jo.	87	Ju.
08	Ka.	28	Ke.	48	Ki.	68	Ko.	88	Ku.
09	La.	29	Le.	49	Li.	69	Lo.	89	Lu.
10	Ma.	30	Me.	50	Mi.	70	Mo.	90	Mu.
11	Na.	31	Ne.	51	Ni.	71	No.	91	Nu.
12	Pa.	32	Pe.	52	Pi.	72	Po.	92	Pu.
13	Ra.	33	Re.	53	Ri.	73	Ro.	93	Ru.
14	Sa.	34	Se.	54	Si.	74	So.	94	Su.
15	Ta.	35	Te.	55	Ti.	75	To.	95	Tu.
16	Va.	36	Ve.	56	Vi.	76	Vo.	96	Vu.
17	Wa.	37	We.	57	Wi.	77	Wo.	97	Wu.
18	Xa.	38	Xe.	58	Xi.	78	Xo.	98	Xu.
19	Ya.	39	Ye.	59	Yi.	79	Yo.	99	Yu.
20	Za.	40	Ze.	60	Zi.	80	Zo.	00	Zu.

૧ ચારો કોલમોના દશ અંકો માટેનો શબ્દ આ અક્ષરોએ ગોઠવવો.

૨ પેહેલા કોલમના સવાલ જવાબોની એ પર્ટીકીલરોનો ૭ અંકો માટેનો શબ્દ આ અક્ષરોએ ગોઠવવો.

૩ પેહેલા કોલમના સવાલ જવાબોની ત્રણ પર્ટીકીલરોના નવ અંકો માટેનો શબ્દ ગોઠવવો હોય તો પહેલા આઠ અંકો આ અક્ષરોએ ગોઠવવા.

બે બે અંક ઓળખવા માટેના જોડાઅક્ષરો. નાં૦ ૨ જો.

00	Ab.	20	Eb.	40	Ib.	60	Ob.	80	Ub.
01	Ac.	21	Ec.	41	Ic.	61	Oc.	81	Uc.
02	Ad.	22	Ed.	42	Id.	62	Od.	82	Ud.
03	Af.	23	Ef.	43	If.	63	Of.	83	Uf.
04	Ag.	24	Eg	44	Ig.	64	Og.	84	Ug.
05	Ah.	25	Eh.	45	Ih.	65	Oh.	85	Uh.
06	Aj.	26	Ej.	46	Ij.	66	Oj.	86	Uj.
07	Ak.	27	Ek.	47	Ik.	67	Ok.	87	Uk.
08	Al.	28	El.	48	Il.	68	Ol.	88	Ul.
09	Am.	29	Em.	49	Im.	69	Om.	89	Um.
10	An.	30	En.	50	In.	70	On.	90	Un.
11	Ap.	31	Ep.	51	Ip.	71	Op.	91	Up.
12	Ar.	32	Er.	52	Ir.	72	Or.	92	Ur.
13	As.	33	Es.	53	Is.	73	Os.	93	Us.
14	At.	34	Et.	54	It.	74	Ot.	94	Ut.
15	Av.	35	Ev.	55	Iv.	75	Ov.	95	Uv.
16	Aw.	36	Ew.	56	Iw.	76	Ow.	96	Uw.
17	Ax.	37	Ex.	57	Ix.	77	Ox.	97	Ux.
18	Ay.	38	Ey.	58	Iy.	78	Oy.	98	Uy.
19	Az.	39	Ez.	59	Iz.	79	Oz.	99	Uz.

૧ બે માણસના ભાવો માટેના દશ અંકોનો શબ્દ આ અક્ષરોએ ગોઠવવો.

એક એક અંક ઓળખવા માટેના દશ અક્ષરો.

B	C	D	F	G	H	J	K	L	M
1	2	3	4	5	6	7	8	9	0

૧ પેહેલા કોઠામના સવાલ જવાબોનો નગ પર્ટીકોલરોના નવ અંકો માટેનો શબ્દ જોડવવો હોય તો છેલા અંક માટે આમાંથી અક્ષર લેવો.

આવેલ ટેલીગ્રાફ વાંચવાની સમજ.

(૧) દાખલો પેહેલો—એડનથી ટ્રીએસ્ટવાળાને તાર મળ્યું કે,

Fenocalaya.

સદરહુ દશ અક્ષરી કોડ બોલનો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ દશ અંકી નંબર ગોઠવવો જેમ કે.

Fe No Ca La Ya
24 71 02 09 19

સદરહુ દશ અંકોને પ્રસ્તાવના પછી પાને ૭ માં શબ્દો (વર્ડો) ગોઠવવા માટેની સમજ બતાવવામાં આવેલ છે, તે મુજબ ચાર ભાગે ચારે કોલમોને વેહેંચી આપવા જેમ કે.

247 પેહેલા કોલમમાં—વેચીએ બતાવેલા ભાવોમાં આનાપાણ વગરની સંખ્યાએ.

102 બીજા કોલમમાં—ખુરશી.

09 ત્રીજા કોલમમાં-ભાવ ૦)≈ાાા ૨ા ૧૧ા≈ ૩૦ ૭૪ાા ૧૭૨ાા ૩૮૨ાા

19 ચોથા કોલમમાં—સંખ્યા ૫૦

એણી રીતે આવેલ તારનો સામટો અર્થ વેચીએ ખુરશીઓ રૂ. ૩૦ ના ભાવે ૫૦ ડજન એમ સમજવું.

એડનમાં ખુરશીઓ ડજનના ભાવે વેચાય છે.

(૨) દાખલો બીજો—કલકત્તાથી એડનવાળાને તાર મળ્યું કે.

Jifegu

સદરહુ ૭ અક્ષરી કોડ બોલનો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ૭ અંકી નંબર ગોઠવવો જેમ કે.

Ji Fe Gu.
47 24 85

સદરહુ ૭ અંકોને પ્રસ્તાવના પછી પાને ૭ માં શબ્દો (વર્ડો) ગોઠવવા માટેની સમજ બતાવવામાં આવેલ છે તે મુજબ બે ભાગે પેહેલા

કોલમમાં વેહેંચી ત્રણ ત્રણ અંકી નંબરો મુકવા અને તે પેહેલા કોલમમાં સવાલ જવાબોની હકીકતોમાં જોવું.

472 ચડાવીએ બારકસ મંડાયું છે.

485 ,, જણાવેલા મારગે ટ્રાન્શીપ.

એણી રીતે આવેલ તારનો સામટો અર્થ ચડાવીએ બારકસ મંડાયું છે જણાવેલા મારગે ટ્રાન્શીપ એમ સમજવું.

(૩) દાખલો ત્રીજો—મુંબઇથી એડનવાળાને તાર મળ્યું કે.

Rewitapok.

સદરહુ નવ અક્ષરી કોડ બોલમાંથી પેહેલા આઠ અક્ષરોના આઠ અંકો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ ગોઠવવા અને તે પછી છેલ્લા નવમા અક્ષર માટેનો એક અંક જે દશ અક્ષરો એક એક અંક ઓળખવા માટેના ગોઠવેલા છે તેમાંથી લેવો જેમ કે.

Re	Wi	Ta	Po	K
33	57	15	72	૪

સદરહુ નવ અંકોને પ્રસ્તાવના પછી પાને ૭ માં શબ્દો (વર્ડો) ગોઠવવા માટેની સમજ બતાવવામાં આવેલ છે તે મુજબ ત્રણ ભાગે વેહેંચી ત્રણ ત્રણ અંકી નંબરો મુકવા અને તે પેહેલા કોલમના સવાલ જવાબોની હકીકતો માટેના સમજીને તે કોલમમાં જોવું.

335 વેચાણ બંધ રાખો.

715 આયાત બીલકુલ બંધ છે.

728 વરસાદની હજુ શુરૂઆત થઈ નથી.

એણી રીતે આવેલ તારનો સામટો અર્થ વેચાણ બંધ રાખો આયાત બીલકુલ બંધ છે. વરસાદની હજુ શરૂઆત થઈ નથી. એમ સમજવું.

(૪) દાખલો ચોથો—હોદેદાથી એડનવાળાને તાર મળ્યું કે.

Eranesozav.

સદરહુ દશ અક્ષરી કોડ બોલનો બીજા નંબરના જોડાઅક્ષરોએ દશ અંકી નંબર ગોઠવવો જેમ કે.

Er	An	Es	Oz	Av
32	10	33	79	15

સદરહુ દશ અંકોને પ્રસ્તાવના પછી પાને ૭ માં શબ્દો (વર્ડો) ગોઠવવા માટેની સમજ બતાવવામાં આવેલ છે તે મુજબ ચાર ભાગે બીજા અને ત્રીજા કોલમોને વેહેંચી આપવા જે નીચે મુજબ.

321 બીજા કોલમમાં આટો મુંબઇ ફ્લૉવર મીલ (હાથી) હવશોહોલ્ડ.

03 ત્રીજાકોલમમાંભાવ. ૦)–।૨)– ૧૦॥=૨૮।૭૧॥ ૧૬૫ ૩૭૨॥

379 બીજા કોલમમાં—ખાંડ લીંશી સફેદ જાવી.

15 ત્રીજા કોલમમાં-ભાવ. ૦।૦।૨।≡૧૨= ૩૧॥૭૮।૧૮૦ ૩૯૭॥

એણી રીતે આવેલ તારનો સામટો અર્થ આટો મોટો હાથી હવશોહોલ્ડ નો. ભાવ રાલ ૧૦॥૧૦ અને ખાંડ જાવી પીશીનો ભાવ રાલ. ૨।૧૫

હોદેદામાં આટો ઉઘડો બસ્તા (ગુણી) ના ભાવે વેચાય છે અને ખાંડ ફ્રાંસલાના ભાવે વેચાય છે.

(૫) દાખલો પાંચમો—ટ્રીએસ્ટથી એડનવાળાને તાર મળ્યું કે.

Vedaponaki. October.

સદરહુ દશ અક્ષરી કોડ બોલનો પેહેલા નંબરના જોડાઅક્ષરોએ દશ અંકી નંબર ગોઠવો જેમ કે.

Ve	Da	Po	Na	Ki
36	03	72	11	48

સદરહુ દશ અંકોને પ્રસ્તાવના પછી પાને ૭ માં શબ્દો (વર્ડો) ગોઠવવા માટેની સમજ બતાવવામાં આવેલ છે તે મુજબ ચાર ભાગે ચારે કોલમોને વેહેંચી આપવા જેમ કે.

360 પેહેલા કોલમમાં—વેચીશું તમોને સી. આઇ. એફ. હારબર જણાવેલા માસથી ત્રણ શીપમેન્ટ દર મહીને સરખે ભાગે.

372 બીજા કોલમમાં—ખાંડ સફેત દાણાદાર બી. આર. બી. અથવા તેને લગતી કુલેટીની.

11 ત્રીજા કોલમમાં-ભાવ ૦)≡। ૨।– ૧૧॥= ૩૦॥૭૫॥ ૧૭૫ ૩૯૨॥

48 ચોથા કોલમમાં—દાગીનાની સંખ્યા ૧૫૦૦.

એણી રીતે આવેલ તારનો સામટો અર્થ વેચીશું તમોને સી. આઇ. એફ. હારબરની સરતે ખાંડ સફેત દાણાદાર બી. આર. બી. અથવા તેને લગતી સીલીંગ ૩ :–૬ પેન્સના ભાવે અકટોંબરથી ત્રણ માસની શીપમેન્ટ તે દર મહીને શીપમેન્ટ બસ્તા (ગુણી) ૫૦૦ લેખે બસ્તા ૧૫૦૦.

——:(૦):——

શુદ્ધિપત્ર.

—:(o):—

પાને ૧ 022 પાંચ શીપમેન્ટને બદલે પાંપ થયેલું છે.

પાને ૪૬ 650 ભય છે ને બદલે જાય છે થયેલું છે.

પાને ૪૬ 665 કર્યું કે કેમ ને બદલે ફર્યું કે કેમ થયેલું છે.

પાને ૪૬ 666 હજુ ફર્યું નહીં ને બદલે હજુ કર્યું નહીં થયેલું છે.

પાને ૫૭ 872 ડામીચ ને બદલે ડામીસ થયેલું છે.

પાને ૫૮ 880 જો તમો ને બદલે જો નમો થયેલું છે.

પાને ૫૮ 883 જો અમો સાટો સોદો ને બદલે સારો સોદો થયેલું છે.

એણી રીતે અમોને જોવામાં આવેલી ભુલોનો સુધારો કરી અત્રે રજુ કર્યું છે તો પણ જો કદાચ સરત ચુકથી રહેલી ભુલ સુજ્ઞ ગૃહસ્થોએ સુધારો કરી દરગુજર કરવી એજ અરજ.

લી૦ કર્ત્તા.

હાજી સુલેમાન ઇસ્માઇલ અંજાર વાળા.

કચ્છી મેમન (મોહોમેદન) ના સલામ.

અગાઊથી ગ્રાહક થઈ ઉતેજન આપનારા સાહેબોના નામ મુબારક.

નંબર.	નામ.	ગામ.	ટેલીગ્રાફીક એડ્રેસ.
૧	શેઠ નુરમોહમદ હાજીમુસાની કું૦	એડન.	Habib.
૨	શેઠ હાજીહસન હાજીઆહમદ.	એડન.	Jafrani.
૩	શેઠ હાજીઇલીઆશ હાજીઅબુ.	હોદેદા.	
૪	શેઠ ઇશહાક હાજી હસન.	હરેર.	Eshak.
૫	શેઠ મહમદ અને હોશેન ઉસમાન.	એડન.	Abdulatif.
૬	શેઠ હાજીઆહમદ સુલેમાન.	ડી. જીબુટી.	
૭	શેઠ હાજીઇલીઆશ સુલેમાન.	ડી. જીબુટી.	
૮	શેઠ મોહમદ હાજીઅયુબ.	એડન.	Ayoob.
૯	શેઠ ઉમર મોહમદ રેહેમતુલા.	એડન.	Stone.
૧૦	શેઠ ખાનુ મુસા.	મુંબઈ.	
૧૧	શેઠ ઇશહાક મીઠા.	ખેડોઈ (કચ્છ).	
૧૨	શેઠ હાજીઉસમાન અલારખ્યા.	કલકતા.	Akbani.

૧૩	શેઠ ખમીશા હાજીજાનમોહમદ મુશા.	એડન.	Khamisa.
૧૪	શેઠ હાજીજાનમોહમદ મુશા એડનવાળા.	મુંબઇ.	Adenwala.
૧૫	શેઠ શલેમાન મુશા.	એડન.	Salmoosa.
૧૬	શેઠ તઇયબ અબુગની.	એડન.	Aboogani.
૧૭	શેઠ યાકુબ ઇશિમાઇલ.	ઝેલા.	
૧૮	શેઠ હાજીઆજમ ગુલામહોસેન.	મુંબઈ.	Ajum.
૧૯	શેઠ ઇસમાઇલજી કરીમજી.	કરાચી.	Gold.
૨૦	શેઠ અબદુલહોસેન જીવાજી.	એડન.	Kakajee.
૨૧	શેઠ દાઉદભાઈ અબદુલરહીમ.	એડન.	
૨૨	શેઠ ગુલામઅલી મુલાં મોહમદઅલીની કંપની.	એડન. ડી. જીબુટી, હરર, દીરીડાવા, અદીસાબાબા.	Mahomedali.
૨૩	શેઠ ગુલામઅલી મુલા મહમદઅલીની કંપની.	સીધપુર.	Reddish.
૨૪	શેઠ ગુલામઅલી મુલા બુકસાભાઈની કંપની.	મુંબાઈ.	Reddish.
૨૫	શેઠ ગુલામઅલી અકબરઅલીની કંપની.	ડી. જીબુટી અને અદીસાબાબા.	Jeevajee.
૨૬	શેઠ હીબતુલાભાઈ મુલા મોહમદઅલીની કંપની.	હરર અને દીરીદવા.	Jeevajee.

અગાઉથી ગ્રાહક થઈ ઉતેજન આપનારા સાહેબોના નામ મુબારક.

નંબર.	નામ.	ગામ.	ટેલીગ્રાફીક અડર્સ.
૨૭	શેઠ હશનઅલી મુલા અકબરઅલીની કંપની.	મુબઈ.	
૨૮	શેઠ મહમદઅલી રસુલજીની કંપની.	હરર.	Rasoolji.
૨૯	શેઠ મહમદઅલી કરીમભાઈ.	હરર અને દીરીદવા.	Karimbhoy.
૩૦	શેઠ ગાંગજી માવજી.	કલકતા.	Useful.
૩૧	શેઠ અબદુલા વલીચાંપસીની કંપની.	એડન.	Valichapsi.
૩૨	શેઠ અબદુલા વલીચાંપશી.	એડન.	Valichapsi.
૩૩	શેઠ હાજીમોહમદ માવજી.	એડન.	Mavjee.
૩૪	શેઠ મેરાલીભાઈ ડોસા.	એડન.	Merali.
૩૫	શેઠ જાનમોહમદ તેજા.	એડન.	Tejabhoy.
૩૬	શેઠ અલીભાઈ લાલજી એન્ડ સન્સ.	બરબરા.	Chhattani.
૩૭	શેઠ જુમા ધનજી.	હરર.	Dhanjee.
૩૮	શેઠ હાજીજુમા પીરમોહમદ.	દીરીદવા.	Hajijooma.
૩૯	શેઠ હાજીઇબરાહીમ આરબ.	એડન.	

૪૦	શેઠ કાસમ શીદીક દલાલ.	એડન.	Sajnani.
૪૧	શેઠ બી. નવરોજજીની કંપની.	પીનાંગ.	Camma.
૪૨	શેઠ જે. બી. પટેલ.	કનતાન (ચીન)	Jehangir.
૪૩	શેઠ ત્રીભોવન ઇનિદરજી.	કલકતા.	Hiramoti.
૪૪	શેઠ જશરાજ ગોકળ.	એડન.	Jasraj.
૪૫	શેઠ દુવારકાંદાસ કાળીદાસ.	એડન.	Lion.
૪૬	શેઠ ધનજી ધારશી દલાલ.	એડન.	Dhanji.
૪૭	શેઠ રતનજી દામજી.	એડન.	
૪૯	શેઠ વનમાળી વીરજી.	એડન.	Vanmali.
૫૦	શેઠ માધવજી હીરજી.	એડન.	
૫૧	શેઠ હીરાચંદ સુંદરજી.	એડન	Hotha.
૫૨	શેઠ વિસનજી નથુ.	એડન.	Nathoo.
૫૩	શેઠ કપુરચંદ લખમીચંદ.	એડન.	Potiphar.
૫૪	શેઠ ખુશાલ રૂપશી. (વસા)	એડન.	Vasakusal.
૫૫	શેઠ દેવચંદ વીઠલ.	એડન.	
૫૬	શેઠ તારાચંદ કરમચંદ	એડન.	Tarachand.
૫૭	શેઠ મુલજી રાઘવજી.	એડન.	Dhakee.
૫૮	શેઠ ભગવાનદાસ ધરમશી.	એડન.	Bhagwandas.
૫૯	શેઠ મેઘજી જગજીવન	મુંબઇ	